



# શ્રી મહાવિર જીન અરધાના ગ્યાન મંદિર

ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR  
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA  
Koba, Gandhinagar - 382 007  
Ph.: (079) 23276252, 23276204-05  
Fax: (079) 23276249



નાથ રાજસ્યકાર્યક્રમ  
ફોનનંબર : ૨૫૨૨

# विषय-दर्शन

बे.कृ. : देख :

१ तारंगा विशे एक पत्र

२ टेलिविजन

३ हुं तो भलो एकलो।

४ अयपरिषष्ठा (स्तवपरिष्ठा)

अने एनी यशोव्याख्या।

५ एकलीसभा वर्णनु विषय-दर्शन

देखकृ. :

पू. पं. श्री. रमणुकविजयल म.

पू. मु. श्री. दर्शनविजयल निपुरी

श्री. रतिलाल दीप्यंद देसाई

प्रौ. हीरलाल र. कापडिया एम. ए.

पृष्ठ :

२४१

२४८

२५१

२५८

२६२



## नवी महाद

इ. ५) मुनिशी गौतमसागरज्ञना सदुपदेशथी-वडादी

## पुस्तक-स्वीकार

पुस्तकनु नाम : क्षमा

देखकृ. : वसंतलाल कातिलाल धर्मलाल

प्रकाशक : सेवनिलाल कातिलाल धर्मलाल ११, कर घेरेड, अहमदाबाद,

टालागा : सुंधर्थ-५

मूल्य : सदुपयोग





॥ उं अहम् ॥

अखिल मारतवर्षीय जैन धेताम्बर मूर्तिपूजक

मुनिसम्मेलन संस्थापित

श्री जैनर्थम् सत्यप्रकाशक समितिनुं मासिक मूख्यपत्र  
जैशिंगभाईनी वाडी : धीकांटा रोड : अमदाबाद (ગुજરात)  
तंत्री : वीभनलाल जोकणहास शाह

वर्ष : २१

विक्रम सं. २०१२ : वीर नि. सं. २४८१ : ई. स. १५५५

क्रमांक

अंक : १२

लादेवा सुह ११ शनिवार : १५ सप्टेम्बर

२७२

## तारंगा विशे एक पत्र

पू. प. श्री. २८३१ कविज्ञाल महाराज

॥६०॥ स्वस्ति श्री अग्नितज्ज्ञन प्रणम्य श्री भगवान्नामाक शुभस्थाने पूज्या-  
राध्य सर्वे उपमा विराजमान सेठलु श्री ५ सेठलु श्री जगतसेठलु श्री  
धुस्यालयंदलु मैडेंताखरायलु सेठलु श्री ५ भद्राराज श्रीजिदोतयंदलु सरूप-  
यंदलु सेठ श्रीगुलाखरायंदलु सेठलु श्रीसमरयंदलु सेठलु श्रीखलैयंदलु  
सेठलु श्रीसुभालयंदलु सेठलु श्रीरेडेंरयंदलु. साह श्री ५ इद्रयंदलु साह  
श्री बायुलु धरमयंदलु बायुलु श्रीप्रसन्नयंदलु राय श्रीह्यालयंदलु साह  
श्री ५ बायु श्रीभूतयंदलु सुगालयंदलु लाईलु श्रीइतेहयंदलु तथा श्री  
आणुयंदलु बायु श्री ५ बडे भोतीयंदलु बायुलु श्रीरतनयंदलु इपयंदलु  
साह श्री ५ सइपयंद गोवर्धननदासलु बायु श्रीभयायंदलु बायुलु श्रीलाल-  
यंदलु बायु श्रीउत्तमयंदलु बायु श्रीसाहभरायलु शाह श्री ५ मानलु  
साहलु समस्त श्रीसंघयरण्णान् श्रीतारंगालु तीर्थथडी विभितं साह भाणुक-  
यंद धरमयंद तथा अडमदावाद नगरवासी सेठ नथमल धुस्यालयंद तथा  
श्रीपाटण्णनगरवासी सेठ डेसरीसिंध शुद्धाखयंद तथा वडनगरवासी सेठ ह्याराम  
पदमसीह तथा श्रीवीसलनगरवासी सेठ मैडता भोदा लीमलु तथा मैडता धुस्याल शुद्धाख  
समस्त श्रीसिंधने जुहार वांचन्योलु. जत अत्र श्रीहेवशुप्रसाहे सुभसाता छे.  
तमारा सुभसाता इप समाचार विखीने अत्र श्रीसिंधने छर्प उपजवयोलु.

भीजुं समाचार १ प्रीछन्योलु-श्रीसिंधायतलु तथा श्रीगिरनारालु श्रीतारं-  
गालु श्रीआयुलु तथा श्रीगोडी यार्थनाथलु स्वामीलुनी यात्रा करवा भाटे  
समस्त श्रीसिंध वेंहला पधारन्योलु. पांच तीर्थनी यात्रा करवानां इव शास्त्रमध्ये  
धधां कहां छे ते वास्ते पांच तीर्थयात्रा करवा समस्त श्रीसिंध वेंहला पधारन्योलु.

२४२ ]

श्री. जैन सत्य प्रकाश

[ वर्ष : २१

तुमे श्रीजिनशासन भेद्ये शोभा वंतं श्रावक छो, तुमे श्रीसंघ समस्त ऐक्षीस  
शुणे करी बिराजमान हो, श्रीजिनशासन उपर राग राखो हो तेह थकी विशेषे  
राष्ट्रज्ञो हो.

ओं ज्ञुं समाचार १ प्रीछल्यो ल श्रीतारंगाल तीर्थं श्रीसिद्धाचलज्ञो हुँक हो.  
ते स्थानक उपर आचार्यल श्रीहेमचंद्रसूरिल पवार्या तिवारे तारंगालनी शोभा  
धाणी हीठी तिवारे शोभा सहित स्थानक ज्ञेय ने मनमां हर्ष धाणुं पाम्या  
तिवारे मनमां भनोरथ कर्यो ने ए स्थानक उपर प्रासाद नीपले तो धाणु लब्ध  
लुव संसारथकी सुभी थाय. एहो भनोरथ करीने राज श्री कुमारपाल भूपालज्ञो  
तीर्थं उपर अक्षित करवानो उपहेश कर्यो. तिवारे राज कुमारपालज्ञों आचार्यलना  
मुष थकी धर्मउपहेश डोमल चित सहित सांख्यो तिवारे राज कुमारपालज्ञ  
धाणुं हर्ष पाम्या हर्ष पामीने राज श्री कुमारपालज्ञों आचार्य श्री हेमा-  
चार्यसूरिलने प्रक्ष पूछयुं ले-स्वामी तीर्थं उपर अक्षित केक्ष रीत थकी करवी ?  
अक्षित तो धाणु प्रकारनी हो, श्री आचार्यल ! तुमें सुझें आज्ञा करो तेहवी  
तीर्थनी तीर्थं समराववानी अक्षित करुं. तिवारे आचार्यल परमहयात थर्य ने कहुं  
ले-श्री तारंगालनो पर्वत श्री सिद्धाचलज्ञो हुँक हो, ए स्थानक उपर अक्षित-  
नाथल स्वामी चोमासुं रह्या होता, ते भाटे ए तीर्थस्थानक उपर श्री अक्षितनाथ  
स्वामीलनो प्रासाद नीपले तो धाणी इडी वात हो. तिवारे राज श्री कुमारपालज्ञों  
परमहयानिधि आचार्यल श्री हेमचंद्रसूरिलना उपहेश थकी तीर्थ-उद्घार  
करवा भंडाव्यो.

उद्घारतुं भंडाव्यु प्रथम पृथकी चोणी सोधावी. सोधावीने प्रथम प्रासादना  
पाठ्यानुं भंडाव्यु कर्युं. प्रासादनो पाठ्यो पृथकी भेद्ये हाथ ६४ ने आसरें हो.  
विस्तारपयें आसपास गज २१ हजारने आसरें हो. ते उपर भूल गलारातुं उच्यपाणुं  
हाथ १२ पने आसरें हो. प्रासादनी शोभा धाणी शोभा सहित शोभा हीसें हो प्रासादनी  
शोभा हेषीने धाणु लब्ध लुव हर्ष पामीं हो ओं ज्ञुं अन्य शासनना राजी पिण्य  
प्रासादनी शोभा हेषीने धाणुं ल राल थायें हो, कहें हों एहों ने नवां प्रासाद  
नीपलवें हो ते सुपात्र सहगतिवंत लुवने धन्य हो, ले लुव ज्ञानं प्रासाद समरावै  
हो ते गुणी श्रावकोने धन्य हो. अन्य शासनना राजी पिण्य प्रासादनी शोभा हेषीने  
मनमां हर्ष पामीने जिन शासन उपर राग करें हो.

ओं ज्ञुं प्रासादतुं काम वरस २६ सुधी राज श्री कुमारपालज्ञों कराव्यु, प्रासाद  
नीपलवतां ३५८१ त्रें संठ डोड थाये हो, प्रासादना शिखर उपर कलशतुं मान  
अभृत भणु १०१ रहे ए प्रमाणे कलशतुं मान हो, कलशनी शोभा धाणी ल  
इडी हो, तीर्थनी अक्षित राज कुमारपालज्ञों करी हुती. तिवार ५३ प्रासादतुं  
काम आकी रह्युं हस्ते ते चतुर्विंधसिंघ मलीने अक्षित करी हुस्तेल.

અંક : ૧૨ ]

તારંગા વિશે અંક પત્ર

[ ૨૪૩ ]

તિવાર ખંડી વરસ ૨૧ થયાં સંઘવી શ્રીતારાચંહ ફૂતેચંહ તથા લાઈ ધરમચંહન્યેં તારંગાલ તીર્થ ઉપર કારથાનું જોડાંયું છે. હિન ૧ પ્રતિ રૂપીયા સ્વાસ્તાને આસરે પરચ છે તે જાણુન્યો છુ. બીજું કુંભારીયેંલ તથા આખૂલું ઉપર કારથાનાનું પરચ રૂપીયા સાદા સાતને આસરે પરચ છે. તીર્થ ઉપર તીર્થની લક્ષ્ણ તુમ સરીયા શ્રીસિંહ શુણીના સહાય થકી લક્ષ્ણ દૂરી રીતે સચ્ચવાયેં છે તે જાણુલું છુ. બીજું શ્રી સિંહ દેશી તથા પરદેશી યાત્રા કરવા આવેં છે તે શ્રી સિંહની સેવા ભલી રીતે સચ્ચવાયેં છેં. સંઘ યાત્રા કરવા આવેં છે તે તિવારે લંડાર મધ્યે પિણુ દ્રવ્ય ઉપને છેં તિમ પરચ થાયેં છેં તે જાણુન્યો છુ.

બીજું શ્રીસિંહ કહેં કે—તારંગાલ તીર્થ ઉપર બાવનજિનાલય કરાવો, જિનનિયંબ નવા લરાવો, પ્રતિક્ષામહોત્સવ કરાવો,—શ્રી સંઘ ઈમ કહેં છે. બીજું બાવનજિનાલય પ્રાસાદ મધ્યે બીજા પ૧ પ્રાસાદ નવાં કરવા છે, પ્રાસાદનું કામ મોટે મંડાણું છે. બીજા પ૧ પ્રાસાદ કરવાનાં મનોરથ છે તે શ્રીસિંહ સહાયથકી મનોરથ સર્વ સંક્રાંતિકા થાયેં છુ, શ્રીસિંહનું ઘર મોટું છે.

બીજું સમાચાર ૧ પ્રીછન્યોલ કે—તીર્થની લક્ષ્ણ વાસ્તેં સમાચાર તુમનેં કિય્યો છે, શ્રી સિંહથકી તીર્થની લક્ષ્ણ કરવી શોખેં તેહવી કરજ્યો છુ, તીર્થ ઉપર કામ તો મોટું છે, શ્રી સિંહથકી લક્ષ્ણ થાયેં તે કરજ્યોલ, શ્રીસિંહથકી લક્ષ્ણ કરવા ચોણ્ય છો, ચોણ્ય જાણી સમાચાર કિય્યો છે છુ.

બીજું સમાચાર ૧ પ્રીછન્યોલ છુ—ધર્મશાલા ૧ નવી કરવા મંડાણી છે, ધર્મશાલા પ્રભુજીના પ્રાસાદનેં સંમીપેં છેં, ધર્મશાલા મધ્યે કોટીયો ૧૭ નીપની છે, કોટીયો આડ જાડી કરવી છેં, ધર્મશાળા મોટે મંડાણું છે તે જાણુન્યોલ. બીજું કૂલવાડી ૧ નવી શ્રીપ્રભુજીની લક્ષ્ણ વાસ્તેં કરવી છેં, કૂલવાડી ધાણું જ સુંહર શોખનીક બની છે તે જાણુન્યો છુ. બીજું ધર્મશાળા તથા કૂલવાડી નીપનાવતાં રૂપીયા ૨૪સેં પરચ થયા છેં તે જાણુલું. ધર્મશાળા મધ્યે રૂપરૂપ હન્જર હૌંટુ કામ જાડી કરવું છે. પ્રાસાદને સંમીપે ધર્મશાલા કર્યાના શુણુ ૬૪ છેં. બીજું ધર્મશાલા કે શાવક નીપનાવેં તથા ધર્મશાલા કરાવ્યાનો ઉપદેશ કરે તેહનેં પિણુ શુણુ ૬૪ છેં, હેડરાનેં સંમીપે ધર્મશાલા હોય તો હેડરા સંબંધી અશાતના પિણુ સચ્ચવાય છુ તે જાણુલું છુ.

બીજું રાજશ્રી સંપ્રતિ થયા તે પુન્યવંત જીવે સંગ્રહાલ પ્રાસાદ નવાં કરાવ્યાં, તથા સવાડોડ શ્રીજિનનિયંબ નવાં લરાવ્યાં, તથા હાનશાળા સાતસેં કરાવી, તથા ઉપાસરા હૌંટુ હન્જર કરાવ્યા, બીજું ધર્મશાલા પિણુ શાણી કરવી છેં તે જાણુલું છુ. બીજું એહાવા શુણુવંત જીવની કરાણી ઉપર દૃષ્ટિ હેઈનેં શુણુવંત જીવ હોય તે શુણુ અંગીકાર કરેં છુ. કે જીવ જિનશાંસન ઉપર બહુ માન કરીનેં

२४४ ]

श्री. जैन सत्य प्रकाश

[ वर्ष : २१

शुणु अंगीकार करें छें ते लुव चोते गुणी थाये छे ल. भीजुं धर्मशाला कर्याना शुणु अनेक छे, धर्मशाला तीर्थक्षेत्र उपर करी होय तो यतुर्विधि सिंधने शाला उपचलानुं स्थानक छैं, ते वास्ते धर्मशालाने समापे भीलु धर्मशाला होय तो धाणु ज शोला सहित स्थानक दीसें ल.

धणु लुव एम कडे छे न—तीर्थक्षेत्र उपर हानशाला होय तो जिनशासननी शोला छे. तीर्थक्षेत्र उपर हानशाला भंडावी होय तो अनेक शुणु छे. पिण्डि धर्मशाला तथा हानशाला भध्ये तो साधारणु द३०य होय ते वावर्यामां आवे ल, साधारणु द३०य तो आशरे उपने छे. ने मुलक थकी द३०य श्रीसिंधि भोक्तृ छे पिण्डि अरक्त स्वलावे भोक्तृ छे ते द३०य अभयकी भीजे क्षेत्रे किम वपराय? खी तो तुमे श्रीसिंधि अभने लिखीने भोक्तस्ये. तिम अमे काम करीस्त्युं ल. तीर्थक्षेत्र उपर भीजन क्षेत्र सचवाय छे. तिवारे तीर्थनी भणिमा अधिक दीसें छे ल. भीजुं हेवकुं द३०य अभयकी भीजे क्षेत्रे केम वपराय? पिण्डि शानी लुवने एम विख्वुं शोले छैः न—नव क्षेत्र भध्ये ने ने स्थानक उपर द३०य वरचवुं शोले छैः ल. खी तो श्रीसिंधि अभने लिखीने भोक्तस्ये. तिम काम करीस्त्युं ल. अमे तो श्री जिनशासना सेवक छुं, श्री जिनशासन जयवंतु वर्ते छैः ल, पिण्डि जिनशासननी भणिमा पुन्यवंत लुवना सहायथकी अधिकतर नोपने ल. अमे तो तुमारा धर्मजिपदेशक मित्र छुं, ने लुवे धर्मजिपदेश कर्या छैः ते पिण्डि शुणी लुव संसार भध्ये सुखी थया छे. भीजुं तीर्थक्षेत्र उपर हर्ष सहित बहुमान करी अज्ञिपूर्वक ने लुव द३०य वावरे छैः ते लुवने अनंत शुण्डी लाल छैः, अहोवा लाल जिनशासन उपर डितकारी लुव सर्व जाणु छै, पिण्डि अहोवा लाल अहा पुन्यवंत लुव होय तेने नोपने ल. श्रीसिंधि तुमे अमारा धर्मभित्र छै. श्री सिंधि तुमे धर्म उपर डित स्नेह राखो छै. ते थकी विशेषे राखनयोल. संसार भध्ये धर्मनी करणी भहा भेठी छे.

भीजुं समाचार १ प्रीछनयोल—श्रीसिंधने पांच पटसा द३०य भोक्तवानी छिं छोय तो श्री सूरत भध्ये संघनी तारायंह इतेयंह तथा श्री पाटणु तथा वडनगर वीश्वलनगर तथा लावनगर एतत्वा गाम भध्ये तुमारी ईछामां आवे ते गाम उपर लवामणु लिखी भोक्तव्ये. तुमारी ईछामां आवे तो श्रीअमहावाह उपर लवामणु लिखी भोक्तव्ये. श्री अमहावाह भध्ये गांधी अझा माधवल तथा करमयंह तलकरी तीर्थनी अक्ति लवी रीते सायवै छे ते जाणजसा ल.

॥ अर्व ७ प्रभाविराजमानं जगतसेतुलं श्री  
पुन्यालयंहल तथा पांच महाजनसमस्त  
श्रीसिंधयस्यान् कागद १ श्रीभगवान्दामाद पोहयै ॥

અંક : ૧૨ ]

## તારંગ વિશે એક પત્ર

[ ૨૪૫

જીપર ને કાગળ છાપેલ છે તે મગસુહાયાદ્વાળા જગતશેઠણું સરનામે ત્યાંના સંધસ્યમસ્ત જીપર લખાયેલ છે. કાગળમાં મગસુહાયાદના નૈન સંધના આગેવાનોની નામ લખેલા છે તેમાં મુખ્ય નામ જગતશેઠણું છે.

ગંગા નહીને કાડે નેમણે કસોઈના પઢ્યો વડે એક મોટું નૈન મંદિર બંધાવેલું તે આ સુપ્રસિદ્ધ જગતશેઠ છે. હાનમાં તેમની ડાઠી મહિમાપુરનાં છે. આ મહિમાપુર અને મુર્શિદાખાદ વચ્ચે ફૂકા પેણું ગાડિનું અંતર છે. અહીં લખેલ મગસુહાયાદ અને વર્ત્માન મુર્શિદાખાદ એ બંને એક જ છે. મુર્શિદાખાદનું એક નામ મશ્વરાયાદ છે અને તેવું જ બીજું ઉચ્ચારણ મગસુહાયાદ છે. જગતશેઠ બંધાવેલા કસોઈન. મંદિરમાં હિરા, પના, નીલમ, માણેક અને કસોઈયોની મૂર્તિએ હતી. આ અસલ મંદિર ગંગાના પ્રવાહથી તૂં ગયું અને સાથે શી જગતશેઠનો મોટા પ્રાસાદ પણ ખચાસ થઈ ગયો. પાછળથી મૂળ મંદિરના થાંભલા વગેરે શાધીને લેગા કરી એક નાનું કસોઈનું મંદિર બનાવેલ છે તે હાલમાં આ મહિમાપુરમાં છે.

જગતશેઠ પછી ને બીજા બીજા ગૃહસ્થોનાં નામો આ કાગળમાં આવેલ છે તેમના વિશે ડાઈ માહિતી તત્કાળ અહીં અમદાવાદમાં એક એક લખી શક્ય એમ નથી. રૂપર્થના હોય અને બંગાળ ભણી જવાય તો મુર્શિદાખાદના વર્ત્માન નૈન ગૃહસ્થો પાસેથી ઇઝરમાં એ માહિતી મેળવી શકાય.

કાગળ લખનારા તારંગાના, અમદાવાદના, પાટણના, વડનગરના અને વીસલનગરના એટલે વીશનગરના નૈન આવડો છે, તેમાં ડેવળ અમદાવાદના શેઠ નથમલ ખુશાલયંદની થાડી ઘણી માહિતી આ પ્રમાણે આપી શકાય.

અમદાવાદમાં હઠીસિંગની વાડીના નામે પ્રસિદ્ધ પામેલું એક વિશાળ નૈન મંદિર છે, એ દિલ્હી દ્વારાન ખાર ધણી વિશાળ જગ્યામાં આવેલ છે. તેને ફરતી બાવન દેરાઓ છે ભાઈ તેને બાવન જિનાલય પણ કહેવામાં આવે છે. તેની કારીગરી ધણી જ સુંદર છે અને આખુના મંદિરની ડાતરણીને ધણીભરી મળતી આવે છે. આ મંદિરને ચણુનાર શિલ્પીની જ્ઞાને આખુના મંદિરનો નમૂનો હતો. તેમાં મૂળનાયક તરીકે ધર્મનાય લગવાનની પ્રતિમાની પ્રતિક્રિયાએલી છે. અમદાવાદમાં આવનાર ડાઈ પણ પરહેશી પ્રવાસી આ મંદિરને લેયા સિવાય પાછો ફરતો નથી. કદાચ અગણણી પાછો ફરતો અમદાવાદનો તેનો પ્રવાસ અધ્યરો રહે છે, એવું આ આગ્રાના તાજમહેલની એમ અમદાવાદનું આકર્ષક સ્થળ છે. એ વાડીના મંદિરની જ્યારે પ્રતિક્રિયાની હતી ત્યારે ભારતભરના નૈન સંગ્રહીને આમંત્રણ આપવા એક કંડોની જાખવામાં આવેલી. તેમાં આમંત્રણ આપનાર તરીકે શા. ખુશાલયંદ નહાલયંદનું નામ છે. એથી એમ અતુમાન થર્ચ શકે છે, કે આ કાગળમાં લખેલ નામ શેઠ નથમલ ખુશાલયંદ છે, તે ખુશાલયંદ. અને આ પત્ર લખનાર નથમલ ખુશાલયંદવાળા ખુશાલયંદ બન્ને એક હોય. જે કે આ મારે વધારે માહિતી મેળવવી હોય તો વાડીના હઠીસિંગ શેઠના વંશનો નેણી અમદાવાદમાં વસે છે અને વાડીનો વહીવર ચલાવે છે તેમને પૂછુથાથી આ આખત વધારે ખુલાસો મળી શકે અથવા વાડીના મંદિરમાં જે લેખ છે તેના ઉપરથી પણ ખુલાસો મેળવી શકાય. આ હકીકત તહેણ સુપ્રસિદ્ધ છે અને મેળવવી સુગમ છે ભાઈ એ વિશે અહીં અપલન નથી કર્યો.

પ્રસ્તુત કાગળમાં સંવાત, ભાસુ વગેરે લખેલ નથી, છતાં આ કાગળ ઓગળીશમા સેકાનો

२४६ ]

## શ્રી જૈન સત્ય પ્રકાશ

{ વર્ષ : ૩૧ }

છે એમાં શક નથી. એક તો એની ભાષા જ એ સમયની છે અને ખુશાલયંદ શેડ લેપેલી પેલી કંડોત્રી ૧૬૦૨ની છે એટલે આ કાગળના સમય વિશે કોઈ વિવાહ રહેણો નથી.

ભાષા તદ્દન સાદી ગુજરાતી અને આજની ગુજરાતીની જેવી છે, ભાત્ર શૈલીમાં થાડો ફરુંદે છે. શખ્દોની શૈલી આ જાતની છે : ‘સંધને બહલે સિંધ’, ‘વહેલાને બહલે વૈંહલા’, ‘તમેને બહલે તુમે’, ‘ગુણો બડેને બહલે ગુણોકરી’, ‘વિશેષને બહલે વિશેષે’, ‘નોઈ ને બહલે દીડી’, ‘અનેને બહલે નીપણે’, ‘સંસારથી ને બહલે સંસારથકી’, ‘હર્ષ ધરો પામ્યા ને બહલે હર્ષ ધર્ષું પામ્યા’. આમાં ધર્ષું એ કિયાવિશેષણ છે. ‘તે વખતે ને બહલે તિવારે’, ‘મહેતા ને બહલે મહેતા’, ‘સમાચાર જાણન્યોજુ ને બહલે સમાચાર ગ્રીજન્યોજુ’, ‘પ્રશ્ન પૂછ્યો ને બહલે પ્રશ્ન પૂછ્યું’. પ્રાકૃત ભાષામાં ‘પ્રશ્ન’ શણદ નાન્યતર જાતિમાં પણ છે. ‘છે ને બહલે છે, છેં અને છે’, ‘કારખાનું કાદ્યું ને બહલે કારખાનું જોડાયું’, ‘પણ ને બહલે પિણુ’, ‘એવો ને બહલે એહોવો’, ‘અમે તો x x x સેવક છીએ’ ને બહલે અમે તો સેવક x x x છું’, ‘સંસારમાં ને બહલે સંસાર મધ્યે’, ‘ધર્ષણા ને બહલે ધર્ષણા, ધર્ષણા’, ‘એટલા ને બહલે જેતલા’, ‘લખી ને બહલે લખીઓ’, ‘તમારી ને બહલે તુમારી’, ‘આવે ને બહલે આવે’, ‘સાચે છે ને બહલે સાચે છે’.

‘કટલાક શખ્દો સંસ્કૃતની છાંટના છે : ‘અનિત જિન પ્રણામ્ય’, ‘શ્રી સંધ્યારણાનું’, ‘જલઅન્ત’.

ઉપર ને ગુજરાતી શખ્દો અતાથા છે તેમાં ‘અમે છું’ એ એક જ પ્રોગ ચાલુ નાગરિક ગુજરાતીથી તદ્દન જુદો પડે છે, પરંતુ એમ જણાય છે કે ગુજરાતની તળપદી કોઈ બોલીગોમાં જરૂર એ પ્રોગ અલારે પણ પ્રયત્નિત હોવો જોઈએ. અમને નાગરિક ગુજરાતીનો વિશેષ પરિયય છે અને ગામેગામ ફરતા રહીએ છીએ તેથી કરીને પણ નાગરિક ગુજરાતીનો પરિયય સુવિશેપ રહેણો હોયા છત્તા પણ એવો ઘ્યાલ રહ્યો નથી કે આવો પ્રોગ ક્યા ગામની વા કયા જિલ્લાની તળપદી બોલીમાં હજુ પણ ચાલુ છે.

આ કાગળમાં એમ લખવામાં આવેલ છે કે અનિતનાથ ભગવાને તારંગા ઉપર ચોમાસું કર્યું હતું. એ વાત વિશે સંશોધન ભાગે છે. ભગવાન મહાવીર પણ શત્રુંજ્ય ઉપર આવેલા એવી દંતક્યા પ્રયત્નિત છે, પરંતુ ભગવાન મહાવીરના ચરિત્રને લગતા ને કે પ્રાચીન અણો અને હેમાચર્ય વળે આચાર્યોએ અનાવેલ તેમનાં જીવનચરિત્રો વર્તમાનમાં મળે છે તેમાં કચાંય એવી વાતની ગંધ સરખી પણ જણાતી નથી કે ભગવાન મહાવીર શત્રુંજ્ય ઉપર આવ્યા હોય. વળી એમ પણ દંતક્યા ચાલે છે કે, ભગવાન વર્ધમાનપુરમાં આવ્યા હતા. આ વર્ધમાનપુર ખરી રીતે સૌરાષ્ટ્રતું વદ્વાણું નથી, પરંતુ યંગળમાં આવેલું આસસોલ જંક્ષન પાસેનું વર્દ્વવાન નગર છે. અને એ વર્દ્વવાનમાં ભગવાન પવારેલા. વર્ધમાન આને વર્દ્વવાન શખ્દો ભળતા આવે એવા છે. તે જ રીતે વદ્વાણું અને વર્ધમાન શખ્દો પણ ભળતા આવે એવા છે એમ સમજુને વિશેપ સંશોધન કર્યા વિના ગમે તે કોઈ એવી વાત ચલાવી કે ભગવાન વદ્વાણુમાં આવ્યા હતા. અને એમના આગમનની યાદી માટે વદ્વાણુમાં એક દેરી પણ જિલ્લી ડરવામાં આવી છે. દેરી ભલે કરી, પરંતુ એ દેરીનો સંખ્યાં કોઈ રીતે વદ્વાણુમાં ભગવાન આવ્યાની હકીકત સાથે લેશ પણ નથી એ અભ્યાસી સંશોધનો બરાબર સમજુ ગમેલા છે. એ જ રીતે તારંગા ઉપર અનિતનાથ ભગવાને ચોમાસું કર્યું હતું, એ વાત પણ એવી જ દંતક્યાંપ છે અને ભાત્ર તીર્થની મહિમા વધારવા અતિશયોક્તિંપ છે. એ સૌ સંશોધકો સમજુ લે.

અંક : ૧૨ ]

## તારંગા વિશે એક પત્ર

[ ૨૪૭

બીજુ વાત એમ છે કે, હેમાચાર્ય પાસે એમ જ્ઞાનવેદ છે કે અજિતનાથ આ તારંગા ઉપર ચોમાસું રહ્યા હતા માટે તેમની લક્ષી માટે માસાદ અંધાવવો એ ઉત્તમ છે અને આ જ્ઞાન પત્ર લખતારે હેમાચાર્ય દ્વારા કુમારપાલને કહેવડાયા છે આ હકીકત પણ સર્વથા દંત-કથાએ છે. અજિતનાથ ભગવાન્તનું તારંગામાં મંહિર અંધાવવાનું જે કારણું પ્રભાવક ચરિત્રમાં આપેલ છે તે નીચે પ્રમાણે છે :

• પ્રભાવકયરિતના અનુવાદક શ્રી. કલ્યાણવિજયલુ મહારાજે આ વિશે જે જણાવેલ છે તેનો સાર નીચે પ્રમાણે છે :

“ સ. ૧૧૬૮ માં સિદ્ધરાજ જયસિંહ પદ્મોક્ષવાસી થથા છે અને કુમારપાલ રાજગાંડી ઉપર ગેડો. ગાહીએ ઐસિને અજિતનાથ આસપાસ આવેલા સપાદ્વક્ષદેશના રાજ અણોરાજ ઉપર ૧૧ વાર ચદાઈ કરી જતાં તેઓ તે રાજને અતી શક્તા નહીં. પછી તેમણે પોતાના મંત્રી વાગ્ભાઈને પૂછ્યું કે, ‘ એવો કાઈ હેલ છે કે જેની માનતા કરીને લડવા જતાં આપણું જુદ થાય ? ’ વાગ્ભાઈ કહ્યું કે શ્રીઅજિતનાથની પ્રતિમા આચાર્ય હેમયંડના હાથે પ્રતિષ્ઠિત કરાવાને સ્થાપન કરી છે તે પ્રતિમા ઘણી ચમતકારિક છે. જે સ્વામી ( કુમારપાલ રાજ ) એ પ્રતિમાની માનતા કરીને પ્રથુભ કરે તો અવસ્થય સફળતા મળી શકે.”

પ્રભાવકયરિત-પ્રથ્યપયાવોચન પૃ. ૧૦૨.

આ જ આખત દીર્ઘને તે જ સુનિરાજ આગળ ચાલતાં જણાવે છે કે, “ કુમારપાલે અણોરાજ ઉપરની ચદાઈ વખતે ભગવાન અજિતનાથની જે માનતા કરી હતી તેની પૂર્તિરૂપે તેણે ( કુમારપાલ રાજને ) તારંગાજ ઉપર ૨૪ ( ચોનીશ ) ગજ બીંચું દેહરું કરાવ્યું અને તેમાં ૧૦૧ એકસો એક અર્ગલ ( ધ્યા ) પ્રમાણે પ્રતિમા સ્થાપિત કરી. ” પૃ. ૧૦૩.

આ ઉલ્લેખ ઉપરથી રૂપ્ય થાથ છે કે કુમારપાલે પોતાના હરીઝ રાજને જિતવા માટે જે માનતા કરી હતી તેની પૂર્તિ કરવા રાજને ( કુમારપાલે ) આ મંહિર અંધાવેદ છે. આ આખત બીજુ પણ સમાનોચ્ચના લાયક હકીકત લખી શકાય એમ છે, પરંતુ અડી તેનો પ્રસંગ નથી એટલે જતી કરીએ છીએ.

કાગળમાં “ મૂલ ગભારાનું બીંચપણું લાથ ૧૨૫ ને આસરે છૈ. ” એમ જણાવેલ છે લારે પ્રભાવકયરિતમાં ૨૪ ગજ બીંચું દેહરું કરાવ્યાની વાત લખે છે તેની સંગતિ કેમ કરીને તે સુમજાનાં આવતું નથી. સંભવ છે કે ૨૪ કે ૨૫ ને અહેલે કાગળમાં ૧૨૫ લખાઈ ગયા હોય.

કાગળમાં લખ્યા પ્રમાણે મંહિરનો વિસ્તાર ઘણો મેરો છે અને તેમાં ખર્ય પણ ધાર્ય મેડું થયેલ છે અને તે કામ ૨૮ વરસ ચાલ્યાનું જણાવેલ છે. એટલે સંભવ છે કે એ કામ પૂરું થતાં વચ્ચે ઘણું વિદ્ધો આચ્યાં હોય અને તેને લઈને જ આટલો અધો સમય લાગ્યો હોય.

• કાગળમાં છેક છેલ્લે લખેલ છે કે જે નો અમદાવાહ ઇન્ધિયા પૈસા મોકદવા હોય તો ગાંધી અષ્ટકા માધવલુ તથા કરમચંહ તલકસીને મોકદવા. આમાં અષ્ટકા માધવલુ તે અમદાવાહની આદ્ધકાશોકની પોળવાળા અષ્ટકા શેઠ હોય અને બીજા નામના પરિચય વિશે કાઈ માર્હિતી કહ્યી શકાય એમ નથી, છતાં અમે વાંચનાર અંધુણાને નભ્રાણે સચ્ચાનીએ છીએ કે આ કાગળ વાંચ્યા પછી તે આખત વા તેમાં લખેલા વિશેષ નામો આખત તેઓ જે હકીકત જણુતા હોય, તે હકીકત અમારા ઉપર લખી મોકદવા જરૂર કરે તો એ દારા સૌને ધાણું જણુવાનું ભણશે.

# टेलिविजन

( ध्वनिप्रसारक, प्रतिषिद्धप्रसारक यंत्र )

लेखक : पूर्ण सुनिराज श्रीदर्शनविजयल मिशन

**भारतमां धृतिलासकण पहेलानी त्रिष्णु दर्शनिक धर्मपरंपराओं मनाय छे :** १, नैन दर्शन, २, बौद्ध दर्शन अने ३, वैदिक दर्शन.

वैदिक दर्शन जगतनी व्यवस्थाभां जगतकर्ता अने धृतिलासकण ने प्रधान माने छे एट्टेले अभां आत्मा अने जड संबंधी वियार करवानी तडे ज नथी. बौद्ध दर्शन इपने-जडने प्रधानता आपे छे, पशु ते साहित्यमां पुहुगलो संबंधी विशेष विवेचन मण्ठु नथी. ज्यारे नैन दर्शन जगतनी व्यवस्थाभां आत्मा अने जड अनेने समझक्ष माने छे, तेथानी गड-मथवारी ज संसार चाले छे एट्टेले नैन दर्शने आत्मा तथा जडपुहुगलोनुं श्रीणुवटभयुं अने तलस्पर्शी वर्णन कर्युं छे. ‘पन्नवासुसत’, ‘लोकप्रकाश’ अने ‘तत्त्वार्थ सत्र’मा अ अंग विशद वस्तुहर्षन भगे छे.

जगवान श्री. महानीरस्वाभीमे लोकमां रहेला मूळ द्रव्योने जुदाजुदा ओणभावी ‘द्रव्यातु-योग’ विसान रजू कर्युं छे. आजनु विसान ध्यान असारा अंशे तेने अनुसरे छे.

साधारणु जनता महान वैशानिकने ओणभती नथी, किन्तु सिनेमा स्टारने सरणताथी ओणभी शडे छे. अे ज रीते साधारणु जनता द्रव्यातुयोग, अनेकांतवाह के आवश्यकिंसा वगेरे सिक्षातीना पुरस्कर्ता जगवान महानीरने न ओणापे अने भध्यम भार्ग वतावनार दर्शनप्रणेताओने ओणापे, अ अनवृं स्वाभाविक छे, किन्तु विचारको ए सिक्षातीने भारतीय प्राचीनहेन मानी जगवान महानीर हेवने पुनः पुनः आपडारे छे.

जगवान महानीरस्वाभीमे परमाणु, आषु, प्रदेश, संधात, विधात, इप, रस, गंध, स्पर्श, पर्याय, कर्मवर्गणा, वर्गणा, शब्द, प्रभा, प्रकाश, छाया, अंधकार धृत्यादि अनेक प्रकारे जड पुहुगलनुं स्वइप स्पष्ट कर्युं छे. प्रत्येक परमाणु रंग, रस, गंध अने स्पर्शवाणा छे अने तेना ते ते शुण्डा स्वतः पख्यो पामे छे अम वतावृं छे. आत्मा पैताना युजुने विकसानी ए परमाणुओनो सहकार लाई हिव्य श्रीन, हिव्य दर्शन, अंतर्घान, अने अनेकइप वगेरे शक्तिने डेणानी शडे छे.

जगवान श्री महानीरे जगतने आरदो व्यवस्थित परमाणुवाह आपे छे. एट्टेले परमाणुवाह ए भारतवर्षीनी हजारो वर्ष पहेलानी देन छे. श्रीन दर्शनकारिये पशु समय जर्ता तेने एक या भीजु रीते स्त्रीकार्यो छे. वैशेषिक अने योगदर्शने तो ए परमाणुवाह पर वष्ट ज्ञेन आप्युं छे. विकमनी ओणणीशामी शताभ्दी सुधी तो ए द्रव्यातुयोग भान्त सिक्षांत इप होतो. भीजु रीते कडी शक्य के ते भान्त अक्षानो विषय होतो. अने तर्कणानी ढाल हुती. परंतु आने तो ए सिक्षांत जगतनी संभेवितानइपे प्रत्यक्ष आनी ज्ञेन रसो छे. अने आजना विसाने एवा एवा आविष्कारो कर्या छे के जे साधारणु जनताने तो यम्भकार झाडु ज लागे. टेलिविजन पशु आवी एक जादुई शाव छे. अतुं भारीकाठिथी अध्ययन

અંક : ૧૨ ]

## દેલિવિજન

[ ૨૪૬

કરીએ તો આપણું એના ભૂળમાં એ પરમાષુપર્યાય અને ગુણપર્યાયના પદથાએ ભરાયર ભળા આવે છે.

દેલિવિજનનો ટૂંકો ધતિહાસ અને પ્રથોગ-પ્રક્રિયા નીચે મુજબ છે :

દેલિવિજનમાં રેડિયો વક્તાના શખ્ફોને દૂર દૂર સુધી લઈ જવાનું, અને દેલિવિજન વક્તાના પ્રાતિબિંબને (ઇપને) દૂર દૂર સુધી લઈ જવાનું કામ કરે છે, એ રીતે ધ્વનિપ્રસાર અને પ્રકાશપ્રસાર એમ એ કાર્યો એક સાથે થાય છે. એમાં રેડિયો શક્તિ મુખ્ય ભાગ ભજવે છે. એમાં તરંગદ્વાર નણું શક્તિઓ હોય છે. એ તરંગોની લંબાઈ અને વેગમાં ફરક હોય છે.

૧. ભિટર (તરંગદ્વાર) : પાસેપાસે રહેલી તરંગોની શાખાઓનો વચ્ચે ગાળો એ તરંગદ્વાર કહેવાય છે. ને ભિટરથી પાંચ શક્તિઓ.

૨. ડ્રેક્વેંસી (ચક્ષસંખ્યા) : ઉપયુક્ત સ્થાનમાં એક સેકંડમાં નેટલા તરંગો પસાર થાય છે તેનું નામ ડ્રેક્વેંસી (ચક્ષસંખ્યા) કે આવૃત્તિ છે.

૩. ઓણી : એ તરંગોની લધુ, મધ્યમ અને હીર્દી એમ નણું ઓણીઓ હોય છે.

વૈશાનિકોને દૂરવીક્ષણું અનાવવા માટે પ્રકાશને વિદ્યુતદ્વારે પરિણામાણી શકે એના પદાર્થની જરૂર હતી. તે અંગે શોધ ચાલુ હતી. બરજીલીપસે ઈ. સ. ૧૯૧૭માં સેલીનિયમ (મેચાયિ) શોધી કાઢ્યો. ધીન વિદ્યાનોએ ડેટલીએક વિભિન્ન નૃતીઓને દૂર કરવા પ્રયત્ન કર્યો. એમે-રિકાના વૈશાનિક વીલાડીભીર કે. નેશનલ ઈ. સ. ૧૯૨૩માં દેલિવિજન યંત્ર જગતની સામે મુક્ષું. અમેરિકાના રેડિયો ડોપેરિશન ઈ. સ. ૧૯૨૮માં ન્યૂયોર્કમાં દેલિવિજન વિભાગ પોલ્યો. નેશનલ ઓડકાર્સિટ્ટ કું.એ દેલિવિજનનું સંચાલન હાથ ધર્યું અને તેણે સંસારમાં સૌથી બીજી ઈમારત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ઈ. સ. ૧૯૩૧માં દેલિવિજન યંત્ર જોડ્યું. અમેરિકાએ ત્યારથી આ વિશ્વાનમાં ખૂલ્ય પ્રગતિ સાધી છે. આને અમેરિકામાં દેલિવિજનનું ડેઝ્રો તથા સંચાહક યંત્રોની વ્યાપક જળ પદ્ધતિએલી છે. શરૂમાં દેલિવિજનમાં એક રંગ હેખાતો હતો, પણ હવે વિવિધ રંગો પણ હેખાય છે.

મતુષ્ય પોતાના ધરમાં આરામથી એડો રહે છે અને દૂર દૂરના ગાયક અભિનેતાઓનાં ગાયન સાંભળે છે, નાય દેખે છે, ચહેરા દેખે છે, અને તેઓના આલેનથ અને હવલાવને હૂંઘુ નિહાળે છે. આ ચંદ્રકારનું નામ છે દેલિવિજન યંત્ર.

દૂરવીક્ષણ એ બહુ જરૂરિય કામ છે. એમાં અભિનેતાના પ્રતિબિંબના લાખો ઇપ્ટો અને આકાશમાં ફેદાય છે, સંચાહક યંત્ર વડે મુંના જોડાય છે અને અસરી પ્રતિબિંબ ઇપે રણૂ થાય છે.

પ્રતિબિંબના ઇપ્ટો-અંડ્રો ફેદાય છે અને મુના જોડાય છે એની વર્ણે તે અનેક સંસ્કારેમાંથી પસાર થાય છે.

ધ્વનિપ્રસારક યંત્ર સાથે એક વિદ્યુત ફેમેરો પણ હોય છે જે દૂરવીક્ષણસેવનમાં ઇપ પ્રસારણનું કામ કરે છે. તે આઈડોનો સ્કેપ તથા ઈ લેક્ટ્રોનિક-ગન (વિદ્યુતઅંદૂક) વડે અભિનેતા અને તેની પાસેની વસ્તુઓના પ્રતિબિંબને વિભાગ અંશોમાં ખાંડિત કરી વિદ્યુત-

२५० ]

## श्री. जैन सत्य प्रकाश

[ वर्ष : ११

तरंगो इपे पक्षयानी हो छे. उमेरानी ऐट पर लाभो संवेदनशील क्षेत्र। पथरथेला होय हो, ने एक्षणीजाथी अप्रभावित होय हो. ऐट उपर ग्रतिभिंभ पडतो ज ए क्षेत्र एक नवी शक्तिनी रचना करे हो, एट्टे प्रकाशमा रहेहु ग्रतिभिंभ विद्युतदृपे परिणामे हो. ए क्षेत्र ए विद्युत दशामां पछु विभाजित ज रहे हो. विद्युतभंडूक ए विद्युतप्रवाहने ताप गति आये हो. —धक्के हो.

आही एक ध्यान राख्युं पडे हो के तरंगप्रवाहनी रेक्वेस्टी ( यक्संभ्या ) ओळामां ओळी ५०,००० किलोसाईक्लिस ( सहसायक ) सुधी पहोळी जली नेहुए.

थीजुं ए पछु ध्यान राख्युं पडे हो के, आळक्षयाणी डेव्ही मोक्षाता ध्वनिनी यक्संभ्या टेलिविजननी यक्संभ्याना मुक्तामां ओळी रहे. कारण ? आळक्षयाणीमां ने भावयामां आवे हो अने तेना ने दीर्घ, मध्यम डे लघु तरंगो घने हो ते पृथ्वीनी सपारीनी उपर ४०थी २५० भार्तीय सुधीना वयवा गाणाना ओपोनोस्फीयर ( अयनभंडण ) मां रहे ए आस जडरी हो. प्रैषक्यत्रे आ भंडल तरह मोक्षेला तरंगो ओळी यक्संभ्या—वाका अने प्रयत्न वेगवाणी होय तो ते आ आकाशभंडणी सहाय्यी आआ जगतमां देवार्थ जय हो. अने प्रैषक्यत्रे आ भंडण तरह मोक्षेला तरंगो धीमा प्रवाहवाणा होय तो ते पछु अद्वा हार्दिक्वेसी ( उय यक्संभ्या ) साथे प्रयत्न वेगवाणा अनी जय हो. परिणामे ए विद्युतप्रवाह ओवे उय अनी जय हो के ते उपर अतावेल अयनभंडणना गाणाने ओणांगी जय हो, त्यां ज नाश पामे हो, ते पाछो आवतो नथी. एट्टे स्पष्ट हो के उक्त आकाशभंडणना गाणामां तरंगो रहे ए छिसाबे ध्वनिनी अने टेलिविजननी यक्संभ्या राखी नेहुए. अने एम थाय तो ज अभिनेताना ग्रतिभिंभतुं विशुद्ध दर्शन थाय हो.

ए विद्युततरंगो रिसीवर ( संग्राहक्यांत्र ) साथे ज्ञेडायेल अनेटना ( रपर्सन्सून ) मां लगावेल सरकिटमां जर्डी पहोळे हो अने त्यां किनैरडोप ( सुशृणनास )मां प्रवेश करे हो.

ग्रतिभिंभ आर्द्धडोनोरडोप अने विद्युतभंडूक वगेवे थंड्रो वडे भंडभंड अनी विद्युततरंग इपे परिणामे हो. ए ग्रतिभिंभ अंडा किनैरडोप थंड्र वडे परस्पर ज्ञेडार्थ असली ग्रतिभिंभ तरीके संग्राहक थंड्रपह पर रवू थाय हो. ग्रतिभिंभेना आ ज्ञेडाणमां विद्युतभंडूक पछु काम करे हो.

ध्वनितुं प्रसारण पछु ग्रतिभिंभप्रसारणी साथे साथे उच्च यक्संभ्यावाका तरंगाथी थाय हो. सेकंडना ५० लाखमा लाग जेट्टो पछु इरक पडे तो विशुद्ध ग्रतिभिंभ दर्शन थतु नथी.

ध्वनितुं प्रसारण पछु ग्रतिभिंभप्रसारणी साथे साथे उच्च यक्संभ्यावाका तरंगाथी थाय हो. टेलिविजनथी आ प्रभाणे दूरथी वरतु देखाय हो.

लगवान भहावीरस्वामींगे दर्थानुयोग सिद्धांतमा द्रव्यपर्याय अने गुणपर्याय अतावा छ. ग्रतिभिंभना अंडा, विद्युतप्रवाह अने ग्रतिभिंभतुं ज्ञेडाण ए सर्वे परमाणु पर्यायनां ग्रन्थक्ष दृष्टांती हो.

क्षेत्रानी जडर नथी के, जैन आगम साहित्यमां वैतानिक तत्त्वना मूळ सिद्धांतो पछु सुरक्षित हो. आ अपेक्षाए पछु जैन दर्शन सर्व दर्शनामां सर्वोत्तम वैतानिक स्वरूप धारी अहुं हो.

# હું તો ભલો એકલો !

દેખક : શ્રી. રત્નલાલ દીપચંહ હેસાઈ

[ ૧ ]

લાઈ લાઈને મારશે ?

સ્તુથેદ્ય થઈ ગયો હતો, ધરતી જણે સોનેરી રસે રસાવા લાગી હતી. સુધી આગસ ભરડી બલી થતી હતી, અને પ્રકાતનું ખુશખુશાલ વાતાવરણ સૌને પ્રકુલ્ય અનાવતું હતું.

મિથિલા નગરિનાં ઉધાનો જલજાતનાં રંગમેરંગી પુષ્પોથી સૌનદર્ય અને સૌરભતું ધામ બની ગયાં હતાં, પદ્ધતીઓને પહેલો કલરવ જણે ધરતીમાની આરતી ઉત્તરતો હતો.

નગરના સુના રાજમાર્ગો જળજ થવા લાગ્યા હતા. રામભાવયના રત્નહીપોએ પોતાનાં તેજ સંક્લી લીધાં હતાં. દાસદાસીઓના રાજવી અને રાજશાલીઓના પ્રાતઃકાર્થની તૈયારીમાં દોડધામું કરતાં હતાં. યંત્રના પ્રેર્ણી હોય એમ સૌ રાજકર્મચારીઓ પોતપોતાના કામે લાગ્યા હતા.

પહેલેક વિવસ ચક્કો અને રાજવી નમિરાજ પોતાના શયનગૃહમાંથી બદાર આવ્યા. એમજું જોયું કે હાથીશાળાનો એક પરિચારક ત્યાં એમની રાહ જોતો ખડો હતો. એજું સમાન ચાર આપ્યા : “ પ્રભુ ! રાજહસ્તી આજે રાત્રિના છેલ્કા પ્રહેર, પોતાનો ખીલો ઉખાડીને, હસ્તિશાળાનાં દોરાને તેડીને જંગલબણી જોપડી ગયો છે. માવતોના અનેક પ્રયત્નો છતાં, તોઝાને ચહેરો એ હાથી, કેમ કર્યો રોક્કો રોકાયો નહીં ; અને ગડિાતૂર બનીને તોડફોડ કરતો નાસી ગયો.”

જીધના બૈનની છેલ્કી અસરમાં નમિરાજને આ સંદેશો સાંકલજો, અને તેણે પરિચારકને વિહાય કર્યો. જીધની જહતા દૂર થઈ અને એ સંદેશો રાજવીના અંતરમાં સળવળવા લાગ્યો : રાજહસ્તી ગડ્ડા બનીને જંગલમાં નાસી ગયો ! એ ગણગણ્ય, અને એમનું મન કંઈક ચિંતનો અનુભવ કરવા લાગ્યું. એમના અંતરસ્પદ પર એ સંકેત રાજહસ્તી અંકિત થઈ ગયો.

નમિરાજને પોતાના આ શૈવ રાજહસ્તી ઉપર ખૂબ પ્રેમ હતો; એને માટે એમને ખૂબ ગર્વ પણ હતો. ગજશાળાનું એ રલ લેખાતો. શિક્ષારમાં સ્કિંધની સામે અને સંમરંગલુમાં શરૂની સામે દોટ મુકુનાર આ રાજહસ્તી રાજણની સવારીનું નાક લેખાતો. એ નાક આજે ચાલ્યું ગયું હતું. અને રાજણ એની વિમાસણુમાં આમેતેમ આઠા મારતા હતા.

પણ એ વિમાસણને દૂર થતાં વાર ન લાગ્યી. રાજની વિશાળ ગજસેના, અશ્વસેના, અને રઘુરંગી જોક્ષાઓની વિરસેનાને આ હાથીને પકડી લાવતાં ડેટલી વાર ?

રાજ-આસ્તી અને રાજનાં બધાં બણો જુદી દિશામાં એ શૈવહસ્તીની શોધ માટે જોપડી ગયાં. દિવસો લગ્ની એમજું ફરતીનેં ખૂશુખૂણો તપાસી લીધો, પણ જણે ધરતીના ક્રોંચ જંડા પેટાળમાં સમાઈ ગયો. હોય એમ, હાથીની કથી ભાગ મળો નહીં.

“ . રેલો હાથી, જણે એને પોતાનું બાળપણ અને બાળકોડાખુબિ સાંકયાં હોય એમ, મદમસ્ત બનીને વિનધ્યાચળ તરફ નાસી છૂટ ચો હતો. હાથીઓને માટે માના જોળા જેવા

२५२ ]

श्री. जैन सत्य प्रकाशः

[ वर्ष : २१

विन्ध्याचणी बांडी बांडी कंदराएँ अने धेरा धेरा॒ जंगलोमां ए तो एवो अदृश्य थर्ड गये।  
हतो॒ के जाणे हतो॒ न हतो॒ थर्ड गये।

हिवसो॒ उपर हिवसो॒ वीतवा लाघ्या; पण॒ हाथीना॒ कशा॒ सभाचार॒ भज्या॒ नहीं॒। छेवटे॒  
सौने॒ खातरी॒ थर्ड के॒ हाथीने॒ शोधी॒ लावनाना॒ सेनाना॒ अरमान॒ जेतरी॒ गयां॒ हतां॒। अने॒ हवे॒  
वात॒ जिकली॒ शके॒ तो॒ अणथी॒ नहीं॒ पण॒ हाथी॒ जिकली॒ शके॒ एम॒ हती॒।

ने॒ कामभां॒ राजसेना॒ पाठी॒ पडी॒, ए॒ काम॒ राजना॒ जासुसोने॒ सोंपायु॒।

जासुसोनो॒ प्रयत्न॒ सङ्कल्प॒ थये। थेाा॒ हिवसेमां॒ सभाचार॒ भज्या॒ के॒ राजनो॒ ए॒ श्वेत॒  
हुरती॒ अस्यारे॒ सुदर्शनपुरमां॒ भाववपति॒ अंद्रधशा॒ राजनीनी॒ हस्तिशालाने॒ शोलावी॒ रखो॒ छे॒।

अने॒ भिथिलापति॒ नभिराजनो॒ हूत॒ ए॒ के॒ हिवस॒ भाववपति॒ अंद्रधशनी॒ राजसभामां॒ जर्झ॒  
पहेंच्यो। एषे॒ भिथिलापतिनो॒ सङ्देशो॒ संभावतां॒ कहुँ॒ : “राजन्। ए॒ श्वेतहस्ती॒ अभारै॒  
छे॒, भाट॒ अभने॒ ए॒ पाठो॒ सोंपो॒ द्यो॒।”

पण॒ भाववपतिये॒ ए॒ भागश्ची॒ नकारी॒ काढी॒ अने॒ हूत॒ आली॒ हाथे॒ पाठो॒ इर्हो॒।

भिथिलापतिये॒ एमां॒ पोतायु॒ अपमान॒ मान्यु॒। अने॒ हा॒ ने॒ नाना॒ वेरनी॒ जेम॒ वात॒  
युक्तने॒ आरणे॒ आवी॒ भडी॒ थर्ड। ने॒ वातनो॒ निकाल॒ राजहूतो॒ न लावी॒ शक्या॒, ए॒ वातनो॒  
निकाल॒ रथुभूमि॒ उपर॒ करवानी॒ धडीयो॒ गण्यावा॒ लागी॒।

नगरै॒ डांडी॒ पडी॒, रथुभेरीयो॒ गालू॒ जही॒ अने॒ ए॒ के॒ हिवस॒ भिथिलापतिना॒ सैन्ये॒ भावव-  
हेश॒ तरइ॒ छूच॒ शङ॒ करी॒। वात॒ एवी॒ तो॒ भमते॒ यडी॒ के॒ ए॒ युक्तनु॒ सेनापतिपद॒ भिथिलापति॒  
नभिराजे॒ पोते॒ लीयु॒ हुरु॒ !

भिथिलापतिये॒ डेवण॒ ए॒ के॒ हाथीने॒ भाट॒ भाववपति॒ उपर॒ करेली॒ यडाईनी॒ वातो॒ नगरीमां॒  
डे॒ डे॒ अने॒ धेर॒ धेर॒ पहेंची॒ गर्छ॒ हती॒। क्लाई॒ ने॒ आवी॒ शरातननी॒ वातोमां॒ आरे॒ रस॒ पउतो॒  
हतो॒, तो॒ क्लाई॒ आवी॒ नकामी॒ छूरता॒ नेई॒ ने॒ विमासथुमां॒ पडी॒ जता॒ हता॒।

नगरीना॒ एकांत॒ प्रदेशमां॒ आवेल॒ ए॒ के॒ धर्मांगारमां॒ ए॒ के॒ प्रशांत॒ साध्वी॒ रहेनां॒ हतां॒। एमना॒  
सेहामण्या॒ इपे॒ संयमनो॒ अंचणो॒ पहेरी॒ लाधो॒ लतो॒। विवास॒ के॒ वैक्षत्वनु॒ त्यां॒ नाम॒ न हुरु॒।  
तप॒, त्याग॒ अने॒ वैराज्यना॒ त्रिवेषी॒ संगमनी॒ ए॒ तीर्थभूमि॒ हतां॒। आधेड॒ वय॒ छतां॒ देहनी॒  
क्षांति॒ अने॒ शीलनी॒ हीांने॒ सौ॒ क्लाई॒ ने॒ एमना॒ प्रत्ये॒ आदरभाव॒ उपजनवती॒। पण॒ आवा॒ आहर॒  
के॒ अनादरनी॒ एमने॒ कक्षी॒ जै॒ येवना॒ न हती॒। हुनियाना॒ रंगाथी॒ ए॒ धराई॒ गयां॒ हतां॒ अने॒  
शील॒ अने॒ सदाचारने॒ यरणे॒ एमणे॒ पोतानी॒ जातनु॒ समर्पण॒ करु॒ हुरु॒। ईद्रियोनो॒ निराध॒,  
हेहु॒ दमन॒ अने॒ भनतु॒ शुद्धिकरण॒—अने॒ ए॒ दारा॒ आत्मानां॒ ओजस्से॒ प्रगटाववा॒ ए॒ सतत॒  
प्रयत्नशील॒ रहेतां॒। ए॒ जै॒ एमनो॒ आनंद॒ हतो॒, ए॒ जै॒ एमनो॒ परभानंद॒ हतो॒। संयमनी॒  
यात्रामां॒ सुख॒ अने॒ शांतिपूर्वक॒ ए॒ अवन॒ वीतावतां॒ हतां॒। ए॒ साध्वीनु॒ नाम॒ हुरु॒ सुवता॒।

आ॒ युक्ती॒ वात॒ न्यारे॒ एमना॒ काने॒ पडी॒ त्यारे॒ एमनी॒ शांतिनो॒ लंग॒ थयो॒, एमनु॒  
चित॒ अस्वस्थ॒ अनी॒ गयु॒, अने॒ एमनु॒ अंतर॒ पोकारी॒ जिक्यु॒ : “लाई॒ लाई॒ ने॒ भारसे॒ ?”

अने॒ बीजे॒ हिवसे॒ नगरजनो॒ ने॒ लेयु॒ के॒ साध्वी॒ सुनना॒ पोताना॒ धर्मांगारने॒ तजुने॒ भाववहेश॒  
तरइ॒ विहरी॒ गयां॒ हतां॒।

અંક : ૧૨ ]

હું તો લદો એકદો !

[ ૨૫૩

[ ૨ ]

તમે તો એય સહોદર !

સુદર્શનપુર નગરે પણ યુદ્ધના પૂરા સાજ સળ કીધા હતા. માલવપતિ પણ મિથિલાપતિથી જરાય એછો જાતરે એમ ન હતો. શરાતનાં વીરસપાન તો એણેથ ખૂબ કર્યો હતાં. મિથિલાપતિનું સ્વાગત કરવા એ પણ તૈયાર હતો. માલવહેશની ચતુરંગી સેનામાં જાણે યુદ્ધના નહે પ્રાણસ્યાર કરી દીધે હતો.

મિથિલાનું સૈન્ય જેમ જેમ આગળ વધતું હતું તેમ તેમ સાંખ્યી સુવતાનો અજપો વધતો જતો હતો. ડો કાળજીનાં બંધનો આજે એમના ચિત્તની સ્વરસ્થનાને હરી લેતાં હતાં. તપ, ત્યાગ અને વૈરાગ્યની સાધના આજે જાણે મનને કાખૂમાં રાખવામાં પાછી પડતી હતી. આજે એમના ચિત્તને શાંતિ ખપતી ન હતી, એમના ટેઢેને આરામ ખપતો ન હતો. કચારે હું માલવહેશભાઈ સુદર્શનપુરના સીમાડે પહોંચી જાઉં એની જ એમેને લગતી લાગી હતી !

રે ભલાં સાંખ્યી ! આ તે વળી ધર્મપ્રવર્તનનાં કેવાં નવાં આકરાં વત આપે આદ્યાં છે ! પણ એનો જવાબ આપવાની એમને નિરાંત નથી.

સૈન્ય આગળ વધે છે; સાંખ્યી આગળ વધે છે.

જાણે બન્નેના પ્રવાસની હોડમાં કોઈક ત્રીજનું લાગ્ય હોડમાં સુકાયું છે.

આગળ...આગળ...આગળ ! પ્રવાસ આગળ ચાલે છે.

આખરે નમિરાજ પોતાના સૈન્ય સાથે માલવહેશને સીમાડે પહોંચી ગયા. માલવપતિ ચંદ્રયશ પણ કાખેલ લડવૈધે હતો. મિથિલાપતિની સાથે સીધેસીધા યુદ્ધમાં જાતરવાને બધાયે એણું એમાં સૈન્યને હંદ્રાવવાને વ્યૂહ જોઈયે. પોતાના આખા સૈન્યને નગરમાં સમાવી લઈને એમણે કિલાના રહવાળ બંધ કરી દીધા.

મિથિલાના સૈન્યે આખા સુદર્શનપુરને વેરો ધાલ્યો. અને બન્ને સૈન્યો એકાંગીજ ઉપર સરસાઈ મેળવવા જાણે તૈયાર થઈ ને ખાં છે !

એ પહાડો જાણે સામસામા અથડાવાની ઘડીની રાહ જોતા એકાંગીજની સામે ખડા હતા. એ ઘડી કચારે આવશે એ કોઈ કહી શકે એમ ન હતું. પણ બધાય એ ઘડીની રાહમાં જાંદી અને આરામ વીસરી ચૂક્યા હતા. પ્રમાદ કર્યો કોઈને પાલવે એમ ન હતો. યોગીના જેવી સતત જગૃતિ સૌના અંતરને આવરી વળી હતી.

સાંખ્યી સુવતા ચાલ્યાં જાય છે. આગળ આગળ ને આગળ ! પેલાં એ સૈન્યોની જેમ એ પણ પોતાની કર્તૃવ્યધડીની જ જપમાળા જપી રહ્યા છે. નણમાંથી ડાની ઘડીને કાળહેવતા જીજળી બનાવે છે, એની જાણે હરીફાઈ જામી છે.

ને એક હિવસ સાંખ્યી સુવતાના કડોર પ્રવાસનો પણ અંત આવે છે. એ સુદર્શનપુરના સીમાડે આવી પહોંચે છે. આજે એમનું અંતર મોડા ન પડચાની નિરાંત અનુભવે છે.

પણ હથ્ય એમને આરામ ખપતો નથી. એ તો સીધાં પહોંચે છે મિથિલાપતિ નમિ. રજની શિબિરમાં.

२५४ ]

श्री. नैन सत्य प्रकाश

[ वर्ष : २१

युद्धवेलो नमिराज पैताना मंत्रीओ अने सामतो साथे सुझना ० यूहुती ज मंत्रज्ञानोमां गूंथायेल छे. एने अत्यारे युद्ध सिवाय भील डाई वात अपती नथी. मालवपतिनी हार अने भिथिकापतिनी ज्ञत ए ज एनुं ज्ञवनस्त्र बन्युँ छे. जाणु चारेकार रुद्रतानुं अयंकर वातावरण आयुँ छे.

अने ए लयानक वातावरणमां, अणभगता रणमां नानी सरभी वाहणी जेम छांटकाव करे एवी पैतानी प्रशांत मुखमुद्राथी शान्तिसन्नो छांटकाव करता साध्वी सुन्तना ए शिखेमां प्रवेश करे छे.

नमिराज अने मंत्रीओ तेमज सामतो तो लैर्ज ज रखा. एमने थयुँ, आ शुँ ? रणभूमि उपर एक अण्णा ! अने ते पछु एक धर्मगुसणी ! अहो एमनुं शुँ काम ? न समजय एवो एक डायडा जाणु अधानो सामे आवीने अडो होतो.

साध्वी तो स्वस्थपणे जिल्लां छे. एमनां अंतरभां डाई अशांति नथी, चहोरा उपर डाई गलराट नथी. आंभेमांथी अभी रेलावतां ए सौने नीरभी रखां छे.

साध्वीना अंतरनो साह जाणु नमिराजना अंतरने स्पर्शी गयो. मंत्रीओ अने सामतो पछु न समजय जाना शाना वले एवी लागणी अनुकरी रखा.

जां डाई काई एवालुं नथी. अधा चिन्वत स्थिर भनी गया छे. शुँ करुँ ? ए जाणु डाई ने समजालुं नथी. पछु सुन्तना तो अडग अडां ज छे. कर्तव्यनो जिल्लार तर्यां वगर पाछा नहीं इच्छानो एमनो निर्णय छे. आवा अधा युद्धवेला मानवीनो एमने देश पछु उर नथी. ए तो अधानां अंतरना झरने नीचोवी नाभवा आव्यां छे. मदारी इषुधरथी उर ए न जने।

ऐ-पांच पल एम ने एम वीती जाय छे. पछु छेवटे सुझनी वेलछा उपर विवेक झाखू भेणव्यो. हाय एम नमिराज जिल्ला थाई सामे जाय छे; एनाथी हाय जेडाई जाय छे; अने ए साध्वीना सामे जई ने एमनुं रवागत करे छे: “पधारो आर्यो ! पधारो !”

मंत्रीओ अने सामतो पछु हाथ जेडीने अडारहे छे.

“धर्मलाल राजन् ! तमने सौने धर्मनो लाल हो। तमारुं, सौ मानवीओतुं अने विश्वना सर्व ज्ञानुं कल्याण थाओयो !”

“आपनी इरपा ! इरपावो आर्यो ! आपने शुँ ज्ञेईए ?”

“मारे जे ज्ञेईए छे, ते भने तमारी पासेथी जडर भगाशे, एवा विश्वासथी ज दुँ अहीं आवी धुं. एवालो, नमिराज ! भने जे ज्ञेईए, ते आपवानी तमे ना तो नहीं कहो ने ?” साध्वीनो अवाज सौनां अंतरने जाणु दोषितो होतो.

नमिराज विचारमां पडी गया. एनी वाणी थांबी गर्दी.

साध्वीने इरी मूँछ्युँ: “राजन् ! शुँ विचारमां पडवा छो ? कहो, एक लिङ्गुणीनी लिक्षा तमे पूरी नहीं करो ?”

“कहो तो भरा, आर्यो ! आपने शानो अप छे ते ?” नमिराज जाणु न छूटके ज्ञाता होता.

અંક : ૧૨ ]

હું તો લવે એકદો !

[ ૨૫૫

“ મને જે જોઈએ છે તે તમે જ આપી શકો એમ છો. તમારા કેવા રાજ્યી સિવામ બીજાનું એ ગળું નથી. એલો ! એલો ! મહાતુલાવ ! તમને મારી વાત કહ્યું છે ? ”

નભિરાજને તો આ બધું જાડે હુવે જેતરવા એવું આકરું લાગ્યું. સાધીની વાતનું તળિયું જ એમને તો ન હેઠાયું. એમણે પૂછ્યું : “ પણ આપની વાત તો કરો ! આપને એવું તે શું ખે કે જે માટે આપ આ સમર્ભભૂમિમાં પદ્ધાર્યાં છો ? ”

“ રાજન ! મારે આહાર, વસ્ત્ર, પાત્ર, નિવાસ ડે બીજા કોઈ ઉપકરણનો ખ્યાં નથી. એ બધાની તો મિથિલામાં કચાં કમિના હતી કે એ માટે આટલો પંથ કાપવો પડે ? —મારે જે ... ”

નભિરાજ વચ્ચાં જ જોલી ઊઠ્યાં : “ મિથિલામાં ? શું આપ મિથિલામાં રહો છો ? મિથિલાથી અહીં આવો છો ? મિથિલામાં ન મળે એવું તે આપને શું જોઈએ છે કે જે મેળવવા મારી પાસે આટલે દૂર આપને આવવું પડ્યું ? આપ મને મિથિલામાં ડેમ ન મળ્યાં અને અહીં ડેમ મળ્યાં ? હું અહીંથી મિથિલા પાણો રૂરું એટલો વખત આપે રાહ જોઈ હોત તો ? ” એના મનમાં પ્રશ્નોની હારભાળા જગી ઊઠી.

“ નભિરાજ ! મારે જે જોઈએ છે તે તમારી પાસેથી અને આ યુદ્ધભૂમિમાં જ મળે એમ છે. અને એટલા માટે તો હું તમારી કૂચના પગલે પગલે વિહાર કરતી અહીં પહોંચી શું. એલો, હવે તો મારું માણ્યું મને આપશો ને ? ”

નભિરાજને ખાતરી થઈ કે આ કંઈ સામાન્ય વાત નહીં હોય. આટલાં કષ્ટ વેહિને સમર્ભભૂમિં પહોંચનાર આ સાધીની વાતનો જેદું પામનો એમને સુશ્કેલ લાગ્યો. મંત્રીએ અને સામનો પણ વિમાસણામાં પડી ગયા. રાજ્યીને તો હા કહેવામાંથી હાણું અને ના કહેવામાંથી હાણું જેવું પડ્યું.

પણ એ પણ વળી સ્તરધંતા છવાઈ ગઈ. છેવટે નભિરાજે અકળાઈને પૂછ્યું : “ પણ આપ આપની વાત કહો તો ખરા ? આપની માગણી શું છે તે સમજલ્યા વગર શું કહી શકાય ? ”

સાધીને લાગ્યું કે હવે વાત કરવાની ઘડી પાકી ગઈ છે. એમણે કહ્યું : “ સાંભળો ત્યારે નભિરાજ ! મંત્રીએ અને સામનો ! તમે પણ સહુ સાંકળને ! આ યુદ્ધભૂમિમાં નભિરાજની પાસે હું યુદ્ધની શાંતિની લિક્ષા માગના આવી શું ! ”

યુદ્ધની શાંતિ ! જાણે વીજળીનો કડકો થયો. બધા સ્તરધંત થઈ ગયા.

“ આપ આ શું કહો છો ? શું આપને આ યુદ્ધની શાંતિ ખે છે ? શું મિથિલાપતિ માલવપતિને પરાજિત કર્યો વગર, પોતાના લાવ લશકર સાથે પાણો ફરી જય એવી આપની માગણી છે ? ”

“ હા, એમ જ. મારી વાત તમે બરાબર સમજલ્યા છો. ”

“ શ્રીઓ થઈને યુદ્ધ અદ્યો અને કાયર જનીને પાણો પડ્યો—એવું કલંક વહેરાને હું આ યુદ્ધ સંક્રાંતિની લાભ એમ આપતું કહેવું છે ? ” નભિરાજનું અંતર ઉશ્કેરણી અતુલવી રહ્યું.

“ રાજન ! જરા સ્વસ્થ થાયો. આમાં ન તો કાયર થવાનું છે કે ન તો કલંક વહેરાનું છે ? એક હાથીને માટે અહંકારના ગુલામ અનીને યુદ્ધને નોતરનું એ કાયરતા કે અહંકારને દૂર કરીને યુદ્ધની શાંતિને નોતરવી એ કાયરતા ? એક હાથીને કારણે હજારો માનવીએના

२५६ ]

श्री नैन सत्य प्रकाश

[ वर्ष : २१

संहारथी पोताना हाथने लोही लीना करवा एक कलंक के हन्तरोना संहारथी पाणा इत्युं एक कलंक ? हाथी वधे के माणुसाई ! एक हाथीने कारणे तमारी माणुसाईने वधेवामां तमने शरातन देखाय छे ? जरा समझे तो भरा । ”

“ ना आर्या ! ना. आप युद्धनी शांतिनी वात न करें, ए सिवाय आपने के घे ते भागे ! ए हाथी हाथी नथी; ए तो भिथिलानुं गौरव अने भिथिलापतिनो गर्व छे. अभारा सौनो ए प्राण छे. अने ए प्राणुना हरनारना प्राण लह्नने ज अमे जंपीयु. ”

“ पण नभिराज ! जरा विचारा तो भरा, असिधारओनुं तांडव ऐवाने निर्देशिनो संहार करवानां छेवटे तमारा हाथमां आववानुं शुं ? हाथी तो आजे छे अने काले नहीं होय, पण तमारी आ संहारकीला डेटलां वाणेने अनाथ, डेटली छोग्याने विधवा अने डेटलां आ-आपेने निराधार बनावशे ? एनो तो कँक्षि विचार करो । ”

“ आर्या ! आ तो समरक्षभि छे. अहीं एवी वातनो शा विचार ? अने तबवारोनो अणुभणुषाट तो अभारे भन बंसरीनो नाह छे. एना एक एक रणक्षरे अभारा प्राण जगी उडे छे, अभारां रधिर जाग्यावा लागे छे अने अभारा देहोभां शक्तिनो संचार थाय छे. ए असिधार अने एना झंकार तो अभारां सदानां साथी । दुनियानुं शुं थरो ए के विचारे ते युद्ध न नोतरी शडे. गमे ते प्रकारे हुङ्मननो पराजय ए ज युद्धनो श्वतमन्त्र। ए भंत्रने तज्वानुं आप न कहेशो । ”

“ त्यारे शुं भारी लिक्षा आजे खाली रहेशो ? ”

“ हु निरुपाय छुं आर्या ! ए सिवाय आपने के नेईए ते भागे. ” साचे ज, लिक्षुणीनी लिक्षा खाली रही.

सुवताने लाघुं के वात वधु मुखेक छे, अने नभिराज जलही भाने एम नथी. एने थयुं, हवे अंतरना लेह उदेत्या सिवाय छूटो नथी. संसारना के लेहोने प्रवन्धनाना अंयाना नीये ढांकी दीधा हता एने आजे उद्याडा कर्म वगर नहीं याके.

ऐमणे कहुं : “ नभिराज ! हु समझ विचारीने अहीं तमारी पासे लिक्षा भागवा आवी छुं. अने भारी लिक्षा भेणव्या वगर हु पाई नथी इख्वानी ए तमे नझो समझ राखने । अने भारु लिक्षापात्र भरी दीधा वगर तमारो पण छूटो नथी, लाईलाईनो संहार करीने शुं भेणववानुं छे ए तो समझे. ”

“ दोषु भाई ? धर्मशास्त्रो जले कहेनां के वधाय मानवीओ भाई भाई छे ! पण एमां भारे शुं ? आ युद्ध ज्ञाने भालवपतिने पराजित करवें, भिथिलाना राजहस्तीने भिथिला लह्न जवो. अने भारा गर्व अने गौरवइप भिथिलानुं भान अभ्यंडित राखुं, एट्यु ज छुं तो समञ्जुं छुं. ”

“ राजन ! हु एवा भाईनी वात नथी करती. हुं तो तमने ए वातनी जणु इख्वा आवी छुं के भिथिलापति अने भालवपति बन्ने एक ज जननीनी कुक्षिथी जनभेला तमे ऐह एक ज भातानां संतानो छो । तमारा अन्तेनां भातापिता एक ज छे. तमे तो ऐह सहेद्दर ! ”

અંક : ૧૨ ]

હું તો લદો એકદો

[ ૨૪૫

મિથિલાપતિ અને માલવપતિ સહેદર ! સૌના અંતરમાં ભારે કડકો થયો, પણ યુક્ષનો નાદ એવો વૈરો બન્યો હતો કે કડકો એમાં સમાઈ ગયો.

સાંઘી સુશ્વતાનો ખીંગે દાવ પણ નિષ્ઠળ ગયો.

[ ૩ ]

હું તમારી જનની !

પણ સુશ્વતાએ સંસારના ધણા રંગ જેથા હતા, એ વૈરાગીણિના અંતરમાંથી અમીરનો જો કંઈ સુકાઈ ગયો ન હતો. પૈતાની ધરેલી વાતને પાર પાડવા માટે કૃતનિશ્ચય અનીને એ હજ નભિરાજની શિબિરમાં જ ભલી હતી.

નભિરાજનું અંતર એની હાજરીમાં ગૂંગળાતું હતું. એને થતું હતું, હવે આ ચાલી જય તો સારું :

ભંગીઓ અને સામંતો પણ અવાક થઈ ગયા હતા.

સુશ્વતાએ એક વધુ પ્રયત્ન આદ્યો. એહું કહ્યું : “ રજનુ ! મારું માનો, અને નાના ભાઈના હાથે મોટા ભાઈનો સંહાર થતો અટકોબો । મંગીઓ અને સામંતો । તમારા રજવીને અંધુકૃત્યાના પાપથી વાસ્વાનો તમારો ધર્મ છે. વડીલ અંધુ તો પિતાતુલ્ય ગણાય ! ”

સૌનાં અંતર દુલિધામાં પડી ગયાં : એક બાળુ યુદ્ધ, યુદ્ધ ને યુક્ષનો નાદ ગાજતો હતો. એમાં ખીંગ બાળુ મિથિલાપતિ અને માલવપતિ બન્ને સહેદર એ લેદ ધૂંયવા લાગ્યો. ધ્રચા અનિચ્છાએ પણ સૌની જિજાસા આ લેદને પામવાને સતેજ થઈ.

એક ભંગીએ પૂછ્યું : “ આર્ય ! આ એ રજવીઓ સહેદર એ નવી વાત વળી આપ કંચાથી લાગ્યા ? ”

સાંઘીએ કહ્યું : “ મહાનુભાવ, અસ્ત્રય નહીં પોલવાનાં અમારાં વત છે. ”

નભિરાજથી ન રહેવાયું : “ પણ આર્ય ! આવી વાત સાચી શેં મનાય ? કચાં હું અને કચાં માલવપતિ ચંદ્રયશ ! અને આપ તો કહો છો, અમે બન્ને સહેદર ! ”

“ નભિરાજ, સાંભળો લારે વાતનો લેદ. માલવપતિ ચંદ્રયશ એ યુગાણુ અને ભહન-રેખાનો પુત્ર થાય. તમે પણ એ જ યુગાણુ અને ભહનરેખાના પુત્ર છો. ”

પણ નભિરાજ એ વાતને ભાનતા નથી. એ તો કહો છે : “ આર્ય ! આપની વાત આપ જાણો ! મારાં માતાપિતા આપ કહો છો તે નથી. પદ્ધત્ય મારા પિતા અને પુષ્પમાલા મારી માતા. આખી દુનિયા આ વાત જાણો છો. અને વળી આપ નવી જ વાત કાં કહો છો ? ”

“ મહાનુભાવ ! એ તમારાં માતાપિતા ભરાં, પણ જન્મ આપનાર નહીં, તમારું પાલન-પોષણ કરનાર ! તમારાં સાચાં ભાતાપિતા તો હું કહું છું તે જ ! તમે અને ચંદ્રયશ બન્ને સહેદર. ચંદ્રયશ મોટા ભાઈ, તમે નાના ભાઈ ! કહો, ભાઈ ભાઈ થઈને હજુથી તમારે યુદ્ધ ચઢું છે ? યુક્ષની શાંતિની ભારી બિક્ષા હજુથી તમારે નકારી છે ? ”

“ આર્ય ! એ જે હોય તે. પણ આને એનું શું ? અમે એ સહેદર હોઈએ કે દુસ્મન અનીને કંપાઈ ભરીએ એમાં આપને શું ? આપ આપનો ધર્મ પાણો, અમને અમારે માર્ગે જવા હો. ”

२५८]

श्री. जैन सत्य प्रकाश

[ वर्ष : २१

“राजन् ! अंतरनां अंधनो उवेखां सहेक्षा नथी. सागना अंचला अने वैरोज्यना आवो रवीक्षरवा छतां ए अंधनो हर थवां सुखेल छे. जननीने ज्वते ज्व, ऐनी नजरती सामे, ए सगालाई ओडभीजनो सांहार करे ए बने भरु ? ”

“जननी ? कैर्ड जननी ? डेनी जननी ? आप आ शुं कहो छा ? ”

“नमिराज ! राजन् ! पुत्रक ! हुं साचुं कडुं छुं. हुं ज तमारी अने अद्रयशनी जननी ! ”

सुनताए पौत्रानुं छेद्यु अख छाडी दीधुं.

नमिराज, मंत्रीओ अने सामंतो स्तप्य थर्द गया. आ ते स्वेत के सत्य ?

वातने बहु वेग आपवा सुनताए पौत्रानी आभी पूर्वकथा कडी संबलानी. नमिराज गहगह छहये ए सांखणी रखा. ऐनां नेत्रा आंसुलीनां थयां.

सुनताने लाञ्छुं के पृथर भीगलशे भरो ! ऐसु छेद्यो सवाल करो ;

“कहो महानुभाव ! युक्तनी शांतिनी उद्योगषां करीने भारु-तमारी जनेतानुं-लिक्षापात्र भरी आपवाने हवे डेट्ली वार छे ? ”

पणु नमिराजनुं अंतर इरी इरीने भाषु युक्तना भभत उपर जर्द ऐहुं हतु. ए भेद्याः “आर्यो ! आप जननी साचां पणु युक्तना विराम. सिवाय जे ज्ञेई ए ते भागी ल्यो ! भारा प्राणु पणु आपने चरणे आपवा तैयार छुं, पणु आ वात भारथी बने एम तथी.”

अने भद्राभासरनी आगली संध्याए कुंतीभाता भद्रारथी कर्णुनी पासेथी भाली हाथे पाणां इर्यां हतां एम, साधी सुनता नमिराजनी शिविरभार्थी भाली हाथे पाणां इर्यां, एमनुं लिक्षापात्र आने भाली रहुं.

[ अपूर्ण ]

## काण्ठ-धर्म

अवेदीवाड आंबलीपैणना जैन उपाश्रये श्रावणु वहि औजना रोज अपेरना चार वागतां उपार्थाय श्री. हेमेन्द्रसागरशु महाराज समाधिपूर्वक काण्ठधर्म पाभ्या छे.



# યથપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યરોવ્યાખ્યા

લે. ગ્રે. હૃરાલાલ ૨. કાપડિયા એમ. એ.

**સુમલાવબાવી** શ્રી. હરિલદસુરિએ ટેટલીક બાયોના નિરૂપણમાં પહેલ કરી છે. એનો એક પૂરાવો તે એમણે રેલી પાંચવથુગ નામની દૂતિ અને એના શિષ્યહિતા નામની સ્વેપજ દીકા છે. આ મૂળ દૂતિના ૧૧૧૦મા થી ૧૩૧૨મા સુધીનાં એટલે કે ૨૦૩ પદો થયપરિણાને લગતાં છે. એના ઉપર શ્રી. હરિલદસુરિની દીકા છે. એને લક્ષ્યમાં લેતાં આ જઈણ ભરહેડી (નૈન મહારાષ્ટ્રી) માં રચાયેલી પદોની સંસ્કૃત ભાષા સહેલાઈથી તિયાર થઈ શકે તેમ છે.

ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયરોવિન્યાગણીએ ટેટલીક પ્રાચીન દૂતિએનું સંપૂર્ણ વિવરણ રચ્યું છે તો પ્રસંગવશાત્ સમુદ્ભૂતિપરિણાની ધર્થી ગાથાઓને અગે એમણે એમની ભિન્ન ભિન્ન દૂતિઓમાં તેમ કર્યું છે, પરંતુ થયપરિણાની તો પ્રયેક ગાથાની સંક્ષિપ્ત વ્યાખ્યા એમણે એક જ દૂતિમાં—પ્રતિમાશાતક (શ્રી. ૬૭) ની સ્વેપજ વૃત્તિ (પત્ર ૨૦૫-૨૪૨) માં કરી છે તે મહત્વની ગણ્યાથ. અહીં એમણે થયપરિણાની તમામ (૨૦૩) ગાથાઓ ઉદ્ઘૃત કરી છે, એની અતિમ (૨૦૩મી) ગાથાની વ્યાખ્યાના અંતમાં શ્રી. યરોવિન્યાગણીએ નણ પદો રચ્યાં છે. તેમાંનું આદ્ય પદ્ય પાઈથમાં છે, ન્યારે આકીનાં એ સંસ્કૃતમાં છે. એ આદ્યપદ

૧. આનું ગુજરાતી ભાષાન્તર 'આગમાદ્ધારક' શ્રી. આનન્દસાગરસૂરિએ કર્યું છે.

એના ઉપૈદ્ધાત (પૃ. ૧)માં થયપરિણાની વિરસતા વિષે નીચે મુજબ વિધાન કર્યું છે:-

"શ્રીય ગણ્યાનું નામની વસ્તુમાં આચાર્યાદિનાં ગુણ અને કાર્યોની સાથે આખા જૈન શાસનમાં અને કોઈ પણ સ્થાને ઉપદ્યક્ત નહિ થતી એવી પૂર્ણિત કુતમાંથી ઉદ્ઘેલી સ્તવપરિજ્ઞાનું વિવેચન કરવામાં આવ્યું છે."

૨. શ્રી.યરોવિન્યાગણીએ સ્વરચિત અનેક અથ્ય સન્મતિ-પ્રકરણને આશ્રીને જ રચ્યા છે એ દર્શાવવા તે તે અથ્યોની ઉદ્ઘૃત કરાયેલી ગાથાઓની સૂચિ એ મતકખના લાખાણ પૂર્વક વીજું પરિશિષ્ટ સન્મતિતર્ક પ્રકરણનો જે જીલ કાંડલ્પ પાંચમે વિભાગ વિ. સં. ૧૬૮માં પ્રકાશિત થયો છે તેમાં અપાયું છે. એમાં આ ઉપાચાર્યાદિનાં આઠ દૂતિઓ નીચે મુજબ ગણ્યાવાઈ છે:-

શાસ્ત્રવાર્તાસમુચ્ચયાદીકા, નાચોપહેશ, અનેકાન્તાયવસ્થા, જ્ઞાનભિન્ન, દ્રોગુણપર્યાયનો નાસ, મહાલીર-સ્તર, ધર્મપરીક્ષા અને શુરૂતત્વવિનિક્ષય.

અહીં શુરૂતત્વવિનિષ્ઠાચ્છ્ય જેવી પાઈથ દૂતિને સંસ્કૃત નામ નિર્દ્દિશ છે તેમજ ઉપર્યુક્ત આઠ દૂતિનાં નામ કોઈ વિશિષ્ટ કેમ આપાયાં હોય એમ જણાતું નથી. એ વાત આજુ ઉપર રાખીએ તે પણ પ્રતિમાશાતક (શ્રી. ૧૫) ની સ્વેપજ વૃત્તિ (પત્ર ૬૨)માં દ્રવ્યસમ્બન્ધતાવને અગે સમુદ્ભૂતિપરિણાની એ ગાથા ઉદ્ઘૃત કરાયેલી હોવા છતાં તેનો ઉલ્લેખ કેમ નથી એ પ્રશ્ન તેમજ શ્રી. યરોવિન્યાગણીએ અન્ય કોઈ દૂતિ પણ નોંધવી રહી તો નથી ગઈ એવા પ્રશ્ન પણ લિએ છે.

ઉપર્યુક્ત પત્ર ૬૨માં એ ગાથા સમુદ્ભૂતિપરિણાનું હોવાનું કર્યું છે. તેમાંની પહેલી નિર્મલિભિત ગાથા જીલ કાંડની રંગમાં ગાથાથી પૂર્વિર્ધ પૂર્વી સિન છે.

ન્યારે બીજી ગાથા જીલ કાંડની ૬૪મી ગાથા સાથે સર્વાંત્રે મળતી આવે છે:-

"છપિ ય જીવનિકાએ સહહમાણો ણ સહદી ભાવા ।

હેવી અપજવેલુ સહદી હોઇ અવિમત્તા ॥"

પાર્દાતર તરીકે આ ગાથાને પૂર્વિર્ધ સન્મતિતર્કપ્રકરણના વિદ્વાન સંપાદકાએ નોંધેલો જણાતો નથી. એ એમ જ હોથ તો તેનું શું કારણ ?

२६० ]

श्री. जैन सत्य प्रकाश

[ वर्ष : २१

थयपरिणामातुं भद्रत्वं दर्शने छ. आ रहुं ए पदः—

“जयह थयपरिणा सारनिष्ठा सुवल्ला

सुगुरुक्यअणुल्ला दाणवकखाणगुल्ला ।

नयनिउणपद्ग्ना हेउदिङ्गुपुल्ला

गुणगणपरिक्ला सब्बदीसेहि सुल्ला ॥ ”

आनो अर्थ हु गुजरातीमां दर्शनुं खुंः—

सारखूल, सुन्दर वर्णवाणी, सुशुरु दारा करयेली अनुसारी युक्त, दानना व्याख्यानथी विश्वापिन, नयोथी अंकित निपुण प्रतिशावाणी, हेतु अने दृष्टांतथी परिपूर्ण, गुणेना सभूहथी व्याप्त अने सर्व दोषेथी रहित ऐवा स्तवपरिणा जयवंती वर्ते छे.

अंतमानां ऐ संरक्षत पद्यो ऐकी पहेलाभां व्याख्याकारे रोताना नाभनो अने रोतानी वाचक पद्यनो उद्देश्य इर्थी छे. विशेषमा कुमतनी वासनारूप विषना विकारतुं वमन करीने हे विषुधे ! सुधासनुं पान करी तृप्त थाओ, ऐम विषुधेने उद्देशने ऐमणे कहुं छे. अंतिम पद्य दारा ऐमणे ऐवा निर्देश कर्यो छे के, अंति स्तवपरिणा वडे लाणी ज गर्द छे तो अन्य तत्रा (शास्त्रो) नी शी जड़ छे ? मुसाइरनी तृष्णा नहीथी दूर थर्ड छे तो पछी दूवाओ छारो लेने होय. आ थयपरिणामाना विवरणना प्रारंभमां पशु थयपरिणामानी भहता दर्शवार्द्ध छे. ऐने लगतुं पद्य नीचे मुझ्य छे :—

“ अथ स्तवपरिणाया प्रथमदेशनादेश्यया

गुरोर्गरिमसारया स्तवविधिः परिस्तूयते ।

इयं सलु समुद्घुता सरसदृष्टिवादादितः

श्रुतं निरघमुत्तमं समयवेदिभिर्भूयते ॥ १ ॥

आनो लावार्थ ए छे के हवे प्रथम देशना दारा दर्शायेली—निःपायेली अने भद्रासारवाणी ऐनी गुरुनी स्तवपरिणा दारा स्तव विधिनो भ्रताव कराय छे. आ स्तवपरिणा सरस दृष्टिभावभांथी सभूयित रीते उद्धृत करार्द्ध छे. अथी सभूयज्ञो ऐने पापरहित अने उत्तम श्रुत कहे छे, उपर्युक्त आध पद्यनी पछीनी पंक्ति नीचे मुझ्य छे :

“ अथ स्तवपरिणाऽऽयन्तोपयोगिनीति यथा पश्चवस्तुके दृष्टा तथा लिखते तैथाहि ”

कहेवानी भत्तव्य ए छे के स्तवपरिणा अत्यंत उपयोगी छे अथी पञ्चवस्तुक्लमां ऐवा जेवामां आवी छे तेवीं हवे लभाय छे. जेमड़े.

विषय—‘थयपरिणाम’ नाममां ‘थय’ (स्तव) शब्द छे अने ए सार्थक छे, तेम्हे आ कृति द्रव्य-स्तव अने भाव-स्तव ऐवा स्तवना ऐ प्रकारा उपर विविध दृष्टिये दाखला हलीक दारा प्रकाश पाउे छे. किनभांहिर अधाववा भाउे केवी भूमि अने देखुं लाकहुं वगेर शुद्ध गण्याय ते आपत अहो विचारार्द्ध छे. काकाहि शुद्ध छे के नहिते आणुवा भाउ शुड्नेनो निर्देश कराये छे. जिन-भिन्न अनाववानो, ऐनी प्रतिधनो तेमज ऐना पूजननो विधि पशु दर्शायेल छे.

3. आना पछी थयपरिणामी आध गाथा आपार्द्ध छे अने ऐनी व्याख्या करार्द्ध छे. आ तेमज अन्य पद्योनी व्याख्याभां छारिसदीय दीक्षनो उपयोग कराया छे.

અંક : ૧૨]

થયપરિણામણા.....યશોવ્યાખ્યા

[ ૨૬૧

દ્રવ્ય-સ્તવ અને ભાવ-સ્તવ વચ્ચેનો ભેદ, રોગના નાશ માટે ઔષધ કેવા અને ઔષધ લીધા વિના રોગ મટાડના વચ્ચેના તદ્વાત જેવો કહ્યો છે.

ભાવ-સ્તવની હુદ્દેરતા સમજાવતી વેળા ૧૮૦૦૦ શીલાંગતું નિશ્પણ કરાયું છે. સંયમના એ પ્રકાર સુચયવાયા છે. તેથી પત્ર ધારણ કરનારનું દૃષ્ટાંત અપાયું છે. ભાવ-સાધુ ડોષ કહેવાય એ બાબતની ચર્ચા કરાઈ છે. સુવર્ણના આડ ગુણો ગણાવી સાધુમાં એની ઘટના કરાઈ છે. દ્રવ્ય એ જ ભાવનું કરાયું છે, એમ પ્રતિપાદન કરાયું છે. ઝૂલાતું દૃષ્ટાંત અપાયું છે. જિનબબનાદિને અગે થતી હિંસા અને વેદવિહિત યત્નાદિમાંથી થતી હિંસા વચ્ચેનું અંતર વિસ્તારથી સમજાવાયું છે. કૃતકૃત્ય પ્રલુની પૂજાથી શું ઇણ એ પ્રશ્ન ચર્ચાયા છે. વેહની અપોરૂપેયતાનું અંડન કરાયું છે. આયુર્વેદમાં આમ દૈવનો નિષેધ કરી રોગના નાશ માટે તેનું વિધાન કરાયું છે એ વાત રજૂ કરાઈ છે. દ્રવ્ય-સ્તવ અને ભાવ-સ્તવના અધિકારી ડોષ છે એ પ્રશ્ન વિચારયો છે. દ્રવ્યસ્તવ એ હાનધર્મરૂપ છે અને શીલાદિક ધર્મો ભાવ-સ્તવરૂપ છે એવું કથન કરાયું છે.

**પ્રકાશન—**નૈન સાહિત્યના મુકુટમણિસમાન થયપરિણામ, હારિબદ્રીય ટીકા, ઐશ્વર્યાખ્યા, સંસ્કૃત છાયા અને ગુજરાતી અતુલાદ તેમજ ખ્યાલપૂરતી સમજુતી અને પ્રસ્તાવના તથા વિસ્તૃત વિષયસૂચી અને પદ્ધતિકમણિકા સહિત ચોચ સ્વરૂપમાં સત્ત્વર પ્રકાશિત થની ધર્મ આના કારણો હું નીચે સુધ્ય દર્શાવું છું:—

(૧) થયપરિણામ એ દિન્હિવાય (દિન્હિવાદ)ના મહાત્વના વિલાગરૂપ પુષ્પવગ્ય (પૂર્વ-ગત)ના ને ચૌહ અંશો છે તેતા એક અંશના પેટાંશરૂપ (પાહૂડ)ના સારરૂપ છે. આમ આ આગમિક દોહન છે.

(૨) થયપરિણામ ખૂબ ઉપયોગી છે એમ ન્યાયાર્થ શ્રી યશોવિજય ગણી જેવાનું કહેવું છે.

(૩) થયપરિણામ અત્યાર સુધી સ્વતંત્ર સ્વરૂપે પ્રકાશિત ર્થિત નથી એટાં જ નહિ પણ ને એ કૃતિમાં એને સ્થાન અપાયું છે એ બંને કૃતિઓ નામે પંચવત્સુગ અને પ્રતિમા શાલકની સ્વોપ્ન વૃત્તિ આજે વેચાતી ભણે તેમ નથી.

(૪) થયપરિણામાના સંપાદન પાછળ વિશેષ પરિશ્રમ કરવો પડે તેમ નથી.

(૫) થયપરિણામ છાવવાનો ખર્ચ ડોર્ધ પણ સમૃદ્ધ શાળી વ્યક્તિને અને સાધારણ સંસ્થાને પણ પોષાક તેવો છે. આ પરિસ્થિતિમાં શ્રી લુરિબદ્ધસુરિના અંશેના અતુરાગીને કે શ્રી યશોવિજય ગણીના કૃતિકલાપના પ્રચારાર્થે પ્રયાસ સેવનારને અને આસ કરીને આ બંને મહારથીઅના સાહિત્યના પ્રેરણને કે નેમને સુવર્ણ અને સુગંધનો શુલ સંયોગ આ કૃતિના પ્રકાશન દ્વારા અનાયાસે પ્રાપ્ત ર્થિત શકે તેમ તેવા ધનિક વ્યક્તિને કે સાધન સંપન્તન સંસ્થાને પચા કૃતિ ઉપર્યુક્ત સામની સહિત સંપાદન રૂપે બનતી ત્વરાએ પ્રકાશિત કરવવા માટે ચોચ પ્રાણી કરવા મારી સાહર વિરાપ્તિ છે. ને એનો સ્વીકાર કરશે તો નૈન શાસનની અને જાણે સાથે એના ઉત્તમ સાહિત્યની પણ થેડી પરંતુ સંગીત પ્રકાશના—સેવા કરેલી ગણુશે.

૪. થયપરિણામાની શ્રી યશોવિજયગ ગણ્યિકૃત વાખ્યા ને પ્રતિમાશાલકની સ્વોપ્ન વૃત્તિમાં મળે છે તેને માટે મેં આ નામ ચોન્નયું છે.

૫. આ કૃતિના જેવા મહાત્વની કૃતિ નાણુપરિણામ (જ્ઞાનપરિણામ) હું એમ લાગે છે. એ કૃતિનો ઉદ્દેશ પંચવત્સુગ (ગા. ૧૩૧૩)ની સ્વોપ્ન ટીકા (પત્ર ૧૮૮૮ચા)માં છે. એ કૃતિ ક્રાઈ સ્થળે સંપૂર્ણ મળે છે ખરી ?

# ‘શ્રી જૈન સત્યપ્રકારા’નું એકવીસમા વર્ષનું વિપથ-દર્શાન

## પ્રાસંગિક નોંધ અને નિવેદન

વીસ વર્ષ પહેલાં	સંપાદકીય	૫૪
સંમેલનની રમતિ અગે	પૂ. આ. શ્રી. ચંદ્રસાગરજી	૧
જૈન કથાસાહિત્યના પ્રેફિસર ડૉ. હર્ટલનો દેખાત નિવેદન	ડૉ. શાલેટે કાઉન્ઝ (સુભદ્રાહેવી) અંક-૫ પૂર્ણ પાતું-૩	૨૫
વિશ્વાસિ	સંપાદકીય	અંક ૮-૯-૧૦
	તંત્રી	પૂર્ણ પાતું-૨
		અંક ૧૧ પૂર્ણ પાતું-૨

## સાહિત્ય

જૈન શાસનમાં શ્રી. ભાગવતી દીક્ષાતું સ્થાન અમણુ લગ્નાન મહાતીરના પૂર્વના ૨૬ લંબો ક. સ. આ. શ્રીડેશચંદ્રસીધરજીની દીક્ષા-કુંડલી દશ આશ્રો	પૂ. આ. શ્રી. વિજયજન્થભૂમુરીશરજી	૫
	પૂ. સુ. શ્રી. મૃગેન્દ્ર સુનિ	૨૦
	પૂ. સુ. શ્રી. દર્શનવિજયજી ત્રિપુરી	૩૩
	પો. શ્રી. હિરાલાલ ૨.	
	કાપ્યિયા એમ. એ.	૩૮-૭૦-૧૦૬
જૈનધર્મનાં ઉમદા તરંગો રાજ્યરામે પહોંચ્યા હાં.	શ્રી. મોહનશાલ દી. ચોક્સી	૧૩૧
અ. મહાતીરની પરંપરા	શ્રી. અમરચંદ માવજી શાહ	૧૪૫

## પ્રતિકાર

‘શાહીરાયાર્થના’ લેખનો અલ્યુટર	પૂ. પ. શ્રી. કનકવિજયજી	૨૮
એક આવસ્થક ખુલાસો	સંપાદકીય	૫૨
અમેરિકાના ટાઈમ પત્રમાં જૈન ધર્મગુરુઓને પૂજનરી તરીકે આગયા	ડૉ. શાલેટે કાઉન્ઝ (શ્રી. સુભદ્રાહેવી)	૭૪

## તત્ત્વજ્ઞાન

કુર્મ-ભીમાંસા	આસ્તર ઘૂંઘરંદ ડેશવલાલ	૪૩-૧૨૮-૧૮૫
---------------	-----------------------	------------

## વાર્તા-કથા

કુતરો ને સંન્યાસી	શ્રી. જ્યલિષ્પુ	૧૭
રાહિણી	પૂ. સુ. શ્રી. નિરંજનવિજયજી	૮૩-૧૦૬
દુંગલ ચિંડિયા	સ્વામી પારલનાથ	૧૪૧

अंक : १२]

## ऐक्यीशभा वर्षनुं विधय-दर्शन

१२६३

सोरहनो सूप्ते ज्ञानाशाख	प. मु. श्री. ज्ञानविजयल	१११
पांच जनमनी ग्रीत	श्री. रत्निलाल हीपयंद हेसाई	१८५
हुं तो भसो ऐडसो	"	२५१

## स्तुति-स्तोत्र-छंद-स्तवन-चैत्यवंदने।

नगोर नव जिन भंहिर रत्नन	श्री. अंवरदावल नाहटा	६७
चतुर्विंशति-जिन-स्तवन	पू. पं. श्री. रमणीकविजयल म.	१८६
श्री ऋषभदासलु कृत पांच		
तीर्थं करोना पांच चैत्यवंदने।	पू. मु. श्री. अभ्यसागरलु म.	२१५
श्रीकृष्णभजिनस्तवनम्	पू. पं. श्री. हुरंधरविजयल गणी	२१६

## धतिहास-पुरातत्त्व-संशोधन

आपणा 'आवश्यक-सूत्र'मां चाकाती अशुद्धिओ	पू. पं. श्री. कृत्याषुविजयल :	८
बीकानेरका बैलोबयदीपक प्रासाद	श्री अगरचंदजी नाहटा	२३
क० सूरचंद्र रचित स्थूलभद्र चरित्र-		

प्रशस्ति	श्री भंवरलालजी नाहटा	४१
मडाइडगच्छकी कालिकाचार्य कथा—		
प्रशस्ति	श्री अगरचंदजी नाहटा	४७
मडाइडा गच्छ	पू. मु. श्री. दर्शनविजयल निपुरी ५६-१८७	

प्रतिकमण्ड-अण्डोध दीकानी शुद्धि-विचारणा	श्री. लालचंद्र ल. गांधी ५७-७८-१०१	१२५
---	-----------------------------------	-----

४५२ देहु रचित गणितसार द्वौमुही ऐक		
अद्वितीय नैन अंथ		
मदन रचित सीमधर स्तवनमें		
ऐतिहासिक उल्लेख		

५. स. आ. श्री. हेमचंद्रसूरीक्षरलुनी दीक्षा—		
दुंडीभां सुधारो		
तेरपंथ सभीक्षा		

६५६८ शुरु		
४५२ देहु रचित मुद्राशास्त्रनो अद्वितीय		
नैन अंथ		

विद्वद्वर्य श्री सुमतिविजय		
अज्ञेना चौहाण राजमे साथे		
नेनायायेना संभूष		

अष्टापदीर्थ-धतिहास		

२६४]

श्री. जैन सत्य प्रकाश

[ पर्द : २१

बहुवर्ष-चिन्तामणिजी मन्दिरके अभिलेख	श्री. भंवरलालजी नाहदा	१६१
अष्ट-भंगल-चित्र-स्तव	प्रौ. हीरालाल २. कापडिया एम. ए. १८०	
वायक यशोविजयनी चैक्सीओ	"	२११
दक्षिणा जैनो अने जैन धर्म	श्री. भोहनलाल दीप्यंह चैक्सी	२२४
उडिसाना भाँद्रो	पू. मु. श्री. दर्शनविजयल निपुरी	२२८
द्विष्ट औरसी ऐव प्रत्युक्ति:		
(८४ भोवविचार) रेखादर्शन	प्रौ. हीरालाल २. कापडिया एम. ए. २३३	
तारंगा विशे एक पत्र	पू. प. श्री. रमणीकविजयल	२४२
टेलिविजन	पू. मु. श्री. दर्शनविजयल निपुरी	२४८
थथपरिषिष्ठा (स्तवपरिष्ठा) अने अनी	प्रौ. हीरालाल २. कापडिया, एम. ए. २५८	
यशोव्याप्त्या		

## प्रकीर्ति

प्रतिनिधित्वधारी संस्थाना आजेवानोने	श्री. भोहनलाल दीप्यंह चैक्सी	३
शहरीओनी सभक्षनानो निवेदो लावो	पू. श्री. कल्याणविजयल	२६
छवंत अँडेर	पू. मु. श्री. यंद्रप्रभसागरल	२७
श्री. शंकराचार्य विशे ए समर्थ		
विद्वानोना अलिग्रामो	संपादकीय	३२
थौवन	पू. मु. श्री. यंद्रप्रभसागरल	४६
जैन मुनिनो वेश द्विमना परदा ५२	श्री. नवजीवन्मु	५१
दीक्षानो प्रश्न सामाजिक नहि किन्तु		
शुद्ध धार्मिंक ७ छ.	पू. आ. श्री. विजयजंभूसुरिल	५३
भान गणे तो तान भणे	पू. मु. श्री. यंद्रप्रभसागरल	७३
बोग्नो परिवार	"	८७
शानी अने समजदार	भद्रात्मा भगवानीन	१२१
अभिषु छवन्तु ध्येय	डॉ. वासुदेवशरण अग्रवाल	१५६
दास्तूपतिजीका भाषण		१७०
साधना द्वारा सिद्धि	पू. मु. श्री. यंद्रप्रभसागरल	१६३
झमापनानु भद्रापर्व श्री. पर्युषिष्ठापर्व	पू. मु. श्री. इयकविजयल	२१७
'श्री जैन सत्य प्रकाश' ने आलु		
राखवा माटे शुं करवुं लेईओ	श्री. जैन	२१७





Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 श्री जैन सत्य प्रकाश

# श्री जैन सत्य प्रकाश

## अंगे सूचना

### योजना

१. श्री. जैनधर्म सत्य प्रकाशक समिति द्वारा 'श्री. जैन सत्य प्रकाश' मासिक १६ वर्ष अर्थात् क्रवामां आवेद्य.

२. एस समितिना आज्ञान संरक्षक तरीके द्वा. ५००४ आ० दाता तरीके द्वा. २००४ आ० सदर्य तरीके द्वा. १००४ राखवामां आवेद्या छे. आ रीते महत् आपनारने कायमने भाटे मासिक भोक्तवामां आवेद्य.

### विनांति

१. पूर्ण आचार्यादि मुनिवरो यतुर्मासन्तु स्थग नक्ती थां अने शेष कायमां जयां विवरता होय एस स्थगन्तु सरनामुं मासिक प्रगट थाय अना १५ हिंस अगाडि भोक्तवता रहे अने ते ते स्थगे आ मासिकना प्रयार भाटे आहो अनाववानो उपहेश आपता रहे अनी विनांति छे.

२. ते ते स्थगेभांधी भणी आवता प्राचीन अवशेषो डे अनिहासिक मालिनी सूचना आपवा विनांति छे.

३. जैनधर्म उपर आक्षेपात्मक लेखा आहिनी सामग्री अने मालिनी आपता रहे अवी विनांति छे.

### आहोने सूचना

१. "श्री जैन सत्य प्रकाश" मासिक प्रयेक अंगेज मालिनी १५भा तारीखे प्रगट थाय छे.

मुद्रक : गोविंदलाल उग्रशीर्षार्थ शाह, श्री शानदा मुद्रणालय, पानडार नाडा, अमहावाह.

प्रकाशक : वीभनलाल गोकुलास शाह.

श्री. जैनधर्म सत्य प्रकाशक समिति कायमलय. जेशिंगलार्नी वाडी, धीकोटा रोड-अमदावाद.

२. आ मासिकनुं वार्षिक लवाजम द्वा. ३ वर्ष रूपिया राखवामां आव्युं छे,


३. मासिक वी. पी. थी. न भंगावता लवाजमना द्वा. ३० भनीज्ञाईदरदारा भोक्तवा आपवाथी अनुदृष्टी रहेशे.

४. आ मासिकनुं नव्युं वर्ष हिंसाथी शङ्क थाय छे. परतु आहोक गमे ते अंकथी अनी शक्ताय.

५. आहोकने अंक भोक्तवतानी पूरी साव-चेती राखवा छतां अंक न भणे तो स्थानिक चैस्ट ऑफिसमां तपास कर्या पछी अभने सूचना आपवी.

६. सरनामुं अदलाववानी सूचना ओगामा ओगा १० हिंस अगाडि आपवी ७३री छे.

### लेखकाने सूचना

१. लेखा आगामी एक तरक वांची शक्ताय  
के (इक्र सांख्य) बोगा भोक्तवा.  


२. लेखा आगामी त्रिया भुदासर अने व्यक्तिगत नेतृत्वात् भोक्तवा नेहू अ.

३. लेखा प्रगट क्रवा न क्रवा अने तेमा पतनी नीतिने अनुसरीने सुधारेवावारो क्रवानी डक तंत्री आधीन छे.